

5<sup>th</sup> September, 2022

To, The Corporate Relations Department **BSE Limited** P. J. Towers, Dalal Street, Mumbai-400001, Maharashtra

Sub.: Newspaper publication of Notice of the 11th Annual General Meeting of the Company & Book Closure Scrip Code: 540492

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper copy of Notice of the 11th Annual General Meeting of the Company & Book Closure published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) newspaper dated 5th September, 2022 as required under Regulation 47 of SEB1 (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Kindly take the same on your record.

Thanking you,

Yours faithfully, For STARLINEPS ENTERPRISES LIMITED

SWATI SOMANI Company Secretary & Compliance Officer ACS No.: 68472

Encl: As above



STARLINEPS ENTERPRISES LIMITED | CIN: L36910GJ2011PLC065141

Formerly known as 'Starline Precious Stone Limited'

Address : Shop - F/1, 1st floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat



A

ATUL

# **FINANCIAL EXPRESS**

ATUL AUTO LIMITED www.atulauto.co.in

Regd. Office : 8B National Highway, Near Microwave Tower, Shapar (Veraval), Dist. Rajkot, Gujarat INDIA 360024. Ph. 02827 235500. E-Mail : investorrelations@atulauto.co.in

## NOTICE OF 34TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, INFORMATION REGARDING E-VOTING

Notice is hereby given that the Thirty Fourth Annual General Meeting ('AGM') of the Company is scheduled to be held on Tuesday, September 27, 2022 at 11.00 am (IST) through Video Conference ('VC') / Other Audio Visual Means ('OAVM') without physical presence of the members at a common venue, in compliance with the provisions of the Companies Act, 2013 and allowed by circular no. 20/2020 dated May 05, 2020 read with circular No. 14/2020 dated April 08, 2020, circular No. 17/2020 dated April 13, 2020, circular No 02/2021 dated January 13, 2021 and circular No 02/2022 dated May 05, 2022 issued by Ministry of Corporate Affairs (MCA) and circular dated May 12, 2020, January 15, 2021 and May 13, 2022 issued by SEBI ("Circulars")

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2021-22 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. The dispatch of Notice of AGM along with Annual Report through e-mail has been completed on September 03, 2022. These documents are also available on the Company's website www.atulauto.co.in/annual-reports.aspx website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and website of NSDL at www.evoting.nsdl.com

In compliance with provisions of section 108 of the Act read with rules made thereunder, as amended from time to time and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Company is providing e-voting facility (remote evoting and e-voting during AGM) to members to cast their vote electronically through electronic voting system of NSDL. All members are informed that:

- All the businesses as stated in the Notice of 34 th AGM may be transacted through voting by electronic means;
- 2. The remote e-voting shall commence at 09.00 AM (IST) on September 24, 2022 and will end at 5.00 PM (IST) on September 26, 2022. The remote e-voting shall not be allowed beyond the said date and time.
- 3. The cut-off date for determining the eligibility to vote by electronic means or to attend AGM is September 20, 2022.
- In case a person has become a member of the Company after dispatch of AGM Notice, but on or before the cut-off date i.e. September 20, 2022, such person may obtain the User ID and Password for e-voting from NSDL by sending an e-mail request on evoting@nsdl.co.in or call at toll free no. 1800 1020 990 and 1800 224 430 and may cast the vote by following the instructions and process of e-voting as provided in the Notice of AGM and on website of NSDL i.e. www.evoting.nsdl.com
- 5. In case of any queries relating to e-voting, members/ beneficial owners may refer the Frequently Asked Question (FAQs) and e-voting user manual available for them at the download section of www.evoting.nsdl.com or call at the above mentioned toll free number or send request to Ms. Sarita Mote, Assistant Manager, NSDL at evoting@nsdl.co.in or the undersigned on the above mentioned contact details who is responsible to address the grievances connected with facility for voting by electronic means.
- The members may note that:

Place : Shapar (Dist. Raikot)

Date : 03-09-2022

- a. Once the e-vote on the resolution is cast by the members, they shall not be allowed to change it subsequently.
- b. The facility for e-voting during AGM is made available for the members who have not cast their vote by remote e-voting;
- c. The members who have cast their vote by remote e-voting may also attend the AGM through VC/ OAVM but shall not be entitled to cast their vote again and;
- d. The person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM;

The members who have not registered their e-mail address with the Company or Depository are requested to register it by following the procedure as mentioned in the Notice of AGM. The manner of remote e-voting and e-voting during AGM for the members who hold shares in physical mode or demat mode or those who have not registered their e-mail addresses with the Company/ Depository Participant are provided in the Notice of AGM.

# STARLINEPS ENTERPRISES LIMITED

(formerly known as Starline Precious Stone Limited) (CIN: L36910GJ2011PLC065141) Reg. Off.: Shop – F/1, 1st Floor, Athwa Ark Shopping Centre, Opp. Yatim Khana, Athwa Gate, Surat-395001, Gujarat. Phone No.: 0261-2600343, Mob.: +91-7043999030 Email: info@starlineps.com, Website: www.starlineps.com

NOTICE OF THE 11TH ANNUAL GENERAL MEETING OF

THE COMPANY & BOOK CLOSURE & E-VOTING INFORMATION NOTICE is hereby given that the 11TH ANNUAL GENERAL MEETING of

the Members of STARLINEPS ENTERPRISES LIMITED (Formerly known as Starline Precious Stone Limited) will be held on Monday, the 26th September, 2022 at 12.30 p.m. (IST) through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM"), to transact the business mentioned in the Notice of the 11th Annual General Meeting sent along with the Explanatory Statement, Directors' Report, Auditor's Report and Audited Financial Statements of the Company for the financial year ended 31st March, 2022.

The Annual Report for the Financial Year 2021-22 containing the Notice has been sent on 3rd September, 2022 to all the Members whose names appears on the Register of the Company as on 26th August, 2022. Please note that there will be no dispatch of physical copies of notices to the members of the Company as per MCA and SEBI circulars regarding relaxation granted for dispatch of physical copies. These documents are also available on the website of the Company and web-link of same is http://www.starlineps.com/Investors-Relations/Annual-Reports/Annual%20Report%202021-22.pdf and on the website of National Securities Depository Limited (NSDL) http://www.evoting.nsdl.com. and on the website of National Securities Depository Limited (NSDL) http://www.evoting.nsdl.com.

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ("remote e-voting") provided by NSDL, on all the Resolutions set forth in the Notice. The details of remote evoting are given below:

- The remote e-voting will commence on Friday, 23rd September, 2022 (9:00 a.m.) and end on Sunday, 25th September, 2022 (5:00 p.m.). The e-voting module shall be disabled for voting thereafter.
- (ii) The voting rights of Members shall be in proportion to their Shares of the Paid-up Share Capital of the Company as of the cut-off date i.e. 19th September, 2022.
- (iii) Any person who acquires Equity Shares of the Company and becomes a Member after 3rd September, 2022, i.e. date of dispatch of the Notice and holding shares as of the cut-off date i.e. 19th September, 2022, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in or info@starlineps.com.
- (iv) Once a vote is cast by a Member, he/she shall not be allowed to change it subsequently.
- (v) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.
- (vi) Mr. Manish R. Patel, (COP: 9360) Practicing Company Secretary of Surat has been appointed as Scrutinizer to ascertain Voting process in a fair and transparent manner.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads section of http://www.evoting.nsdl.com / or contact Mr. Ketan Patel, Authorised official of NSDL, 4th floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Lower Parel, Mumbai-400013; at e-mail: ketankumarp@nsdl.co.in Telephone No.: 022-24994200 & Toll Free No.: 1800-222-990.

Notice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 20th September, 2022 to 26th September, 2022 (both days inclusive).

TATA CAPITAL HOUSING FINANCE LIMITED

Regd. Office: 11th Floor, Tower A. Peninsula Business Park, Ganpatrao

NOTICE

TATA Kadam Marg, Lower Parel, Mumbai-400013 CIN No.: U67190MH2008PLC187552

Under Section 13 (2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security

MAND

# **KATHIAWAR INDUSTRIES LTD.** CIN: U91110GJ1944PLC000778

Regd. Office: At & Post Village Sherbaug, Taluka Malia Hatina, Junagadh (Gujarat). M. 09825124996 E-mail : vamacons1@gmail.com

## NOTICE OF ANNUAL GENERAL MEETING **OF KATHIAWAR INDUSTRIES LIMITED FOR** REMOTE E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 78" Annual General Meeting (AGM) of the nembers of the Kathiawar Industries Limited will be held on Saturday24" September, 2022at 12:00 P.M. at Hotel Murlidhar and Garden Restaurant, Survey No. 76/p/4, Junagadh-Veraval Highway Road, Gadu(Sherbaug), Junagadh, Gujarat, Indiathe following businesses to transact the business as set out in the Notice of Extra Ordinary General Meeting. Please note that in compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 read with Amendment Rules, 2015 the Company is pleased to provide remote e-voting facility to its Members to exercise their right to vote on all the Resolutions set forth in the Notice convening the AnnualGeneral Meeting scheduled to be held on Saturday 24"September, 2022at 12:00 noon.

The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") for providing e-voting facilities to the Shareholders. 1. The Special businesses set out in the Notice AGM may be transacted

through voting by electronic means and by taking poll at the Annual General Meeting.

2. The cut-off date for the purpose of determining the eligibility to vote by electronicmeans or at AGM isSunday, 18"September, 2022. A member, whose name appears in the Register of Members/Beneficial Owners as at the close of the business hours on the cut-off date i.e., Sunday, 18"September, 2022 only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the General Meeting. 3.Date of commencement of e-voting: Wednesday21°September, 2022 from 09.00 A.M.

4.Date of end of e-voting: Friday,23"September, 2022 till 05.00 P.M (E-voting through electronic mode shall not be allowed beyond 05.00 P.M) 5.Member may participate in the General Meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.

6.Any person, who acquires shares of the company and becomes member of the Company after dispatch of the notice of the AGM and holding share as of the cut-off date i.e. is Thursday 1" September, 2022 may obtain the login ID and password by sending request at evoting@nsdl.co.in however if a person is already registered with NSOL for e-voting then existing user ID and password can be used for casting vote; Members may be note that ; a) the remote e voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting through ballot papers shall be made available at the venue of AGM; c) the members who have cast their vote by remote e-voting facility may also attend the AGM but shall not be entitled to cast vote again; and d) A person whose name is recorded in the Register of Members and list of Beneficial Owners as on the cutoff date i.e. is Sunday, 18"September, 2022only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM through ballot paper;

Pursuant to the provision of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies/Management and Administration) Rules. 2014 read with Amendment Rules, the Register of Members and Share transfer books shall remain closed from Wednesday 21"September, 2022 TO Saturday 24"September, 2022for the purpose of AGM In case of any queries, you may refer the Frequently asked questions (FAQ's) for members and remote e-voting user manual for members available at download section of www.evoting.nsdl.com or call on toll free no. : 1800-222-990.

Date: 03-09-2022

Place: Gadu Sherbaug



Whereas, the undersigned being the Authorised Officer of The South Indian Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with rule 3 of the Security interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 22-06-2022 u/s. 13(2) of the Act calling upon the borrower, M/s Muan Jewels Pvt Ltd, Having Registered Office At-Plot No.695, Block-B Ground to Third floor, B/s Diwali Baug, French Garden, Athwagate Surat, Gujarat-395007 Also At, CS695, Dumas Main Road, Near Dhira Sons, Athwagate, Surat, Gujarat-395001, and Guarantors, 1) Mr Baharali Anverali Shaikh, 12/2732, Aganowad, Waki Bordi Saiyedpura, Gujarat-395003 Also At, 12/2661, Vanki Bordi, Kavina Street Bibi Ni Wadi, Salyedpura, Surat, Gujarat-395003, and 2)Mr Saharali Anvarali Shaikh, 12/2877-78, Bibi Ni Wadi, Parsi Agiyari, Saiyedpura Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street Bibi Ni Wadi, Saiyedpura, Surat, Gujarat-395003, and 3) Mr Kausharali Anvarali Shaikh , 12/2668, Bibi Ni Wadi, Waki Bordi, Saiyedpura Surat , Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street Bibi Ni Wadi, Salyedpura, Surat, Gujarat-395003, and 4) Mr Zoherali Anvarali Shaikh, 12/2720, Aganowad, Parsi Agiyari, Saiyedpura, Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street, Bibi N Wadi, Saiyedpura, Surat, Gujarat-395003, and 5) Mr Imranali Baharali Shaikh, CS695, Dumas Main Road, Near Dhiraj Sons, Athwagate Surat, Gujarat-395001, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street. Bibi Ni Wadi, Saiyedpura, Surat, Gujarat-395003, and 6) Mrs Muktezabibi Baharali Shaikh, 12/2732-A, Aganowad, Parsi Agiyari Saiyedpura, Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street, Bibl Ni Wadi, Saivedpura, Surat, Gujarat-395003, and 7) Mrs Samsulnahar Saharali Shaikh, 12/2877-78, Bibi Ni Wadi, Parsi Agiyari, Saiyedpura, Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street, Bibi Ni Wadi, Saiyedpura, Surat, Gujarat-395003 and 8) Mrs Sarifabibi Kausharali Shaikh @ Shaikh Sarifabibi K 12/2668, Bibi Ni Wadi, Parsi Agiyari, Salyedpura, Surat, Gujarat 395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street, Bibi Ni Wadi Salyedpura, Surat, Gujarat-395003, and 9) Mrs Masturabibi Zoherali Shaikh @ Shaikh Masturabibi Z, 12/2720, Aganowad, Parsi Agiyari Saiyedpura, Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi Kavina Street, Bibi Ni Wadi, Salyedpura, Surat, Gujarat-395003, and 10) Mrs Zannatul Ferdous Imranali Shaikh @ Shaikh Zannatul Ferdous 1, 12/2732, Bibi Ni Wadi, Parsi Agiyari, Salyedpura, Surat, Gujarat-395003, Also At, 12/2661, Vanki Bordi, Kavina Street, Bibi N Wadi, Salyedpura, Surat, Gujarat-395003, to repay the amount mentioned in the notice being Rs 16,26,18,020.20 Rupees Sixteen Crore Twenty Six Lakh Eighteen Thousand Twenty And Paise Twenty) as on 21-06-2022 with further interest and costs within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby giver to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 30th day of August 2022

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the Property and any dealings with the property will be subject to the charge of The South Indian Bank Ltd. for an amount of Rs.16,65,22,966.07 (Rupees Sixteen Crore Sixty Five Lakh Twenty Two Thousand Nine Hundred Sixty Six and Paisa Seven onle) as on 29.08.2022, and interest and costs thereon

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

## DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES

Item No. 1: All that part and parcel of property in the name and style as "Muan Jewels"admeasuring 590.30 Sq.Meters along with multi storied building thereon and all other constructions, improvements, easementary rights existing and appurtenant thereon situated at Athwagate Diwalibaug Vrea, Main Road, Surat in Ward No.13(Athwa) under Sy Nos.13/2 & 14,09

Pursuant to section 91 of the Act read with rules made there under and regulation 42 of the SEBI (LODR) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 21, 2022 to September 27, 2022 (both days inclusive) for the purpose of AGM.

> By order of the Board of Directors of ATUL AUTO LIMITED (Paras J Viramgama) **Company Secretary & Compliance Officer**

Place: Surat

Date: 03/09/2022

By Orders of the Board of Directors For STARLINEPS ENTERPRISES LIMITED (formerly known as Starline Precious Stone Limited)

> SWATI SOMANI Company Secretary & Compliance Officer ACS No.: 68472

Certified to be True Copy By Order of the Board of Directors For Kathiawar Industries Limited Sd. Naresh S. Radia Director [DIN: 02276146]

City Sy Nos.3 & 2Part, City Sy Nondh No 695 of Sub District City Choryasi, Surat District and owned by Mr Baharali Anverali Shaikh,Mr Saharali Anvarali Shaikh,Mr Kausharali Anvarali Shaikh and Mr Zoherali Anvarali Shaikh, more fully described in Sale Deed Nos.2729/13 dated 21.02.2013 of Sub Registrar Office Surat and bounded on. North :C.T.S. No.701 & 702, East: C.T.S. No.696 South: Road, West: C.T.S No.694(Dhiraj Megha Store)

Item No. 2: All that part and parcel of property admeasuring 246-65-83 Sq Meters along with construction of ground floor plus two floors having a built up area of about 9941.37 Sq.Ft and all other constructions improvements, easementary rights existing and appurtenant thereor situated at Saivedpura Aganovad Area in Ward No.12 Saivedpura under City Sy.Nondh No.2732 of Sub District Taluka Choryasi, Surat Distric and owned by Mr Baharali Anverali Shaikh, Mr Saharali Anvarali Shaikh,Mr Kausharali Anvarali Shaikh and Mr Zoherali Anvarali Shaikh, more fully described in Sale Deed Nos.14183/2006 dated 20.12.2008 of Sub Registrar Office Surat and bounded on. North : Wall of Adjoining Property, East: Street Road South: Street Road, West: House No.12/2733 Date : 30.08.2022 Authorised Officer Place : Surat The South Indian Bank Ltd.

	SMALL FINANCE		Interest Act, 2002 ("Act") read with Rule 3 of Whereas the undersigned being the Ac	thorised Officer of Tata	Capital Housin	ng Finance		केन	रा बैंक Canara Bank sA			i - Il Branch
movable assets from which is going to b Commercial Bank) t otherwise the movab their own cost and the	d Borrowers & Co-Borrowers are the mortgaged property (ment be sold by AU Small Finance hrough auction proceeding un ble assets would be transferred hey will also be liable for any d	oned in the below table) Bank Ltd. (A Scheduled der SARFAESI Act. 2002, to any rented location at amage caused during the	Limited (TCHFL) under the Act and in e read with Rule 3 of the Rules already is Section 13(2) of the Act, calling upon singularly or together referred to 'Oolige hereunder, to pay the amounts mentione from the date of the respective Notice Notices are served by Registered Post A	sued detailed Demand M the Borrower(s)/Co-Bor ors")/ Legal Heir(s)/Lega d in the respective Dema s, as per details given .D, and are available with	Notices dated be rrower(s)/Guara al Representativ and Notice/s, with below. Copies of h the undersigned	elow under intor(s) (all re (s) listed hin 60 days of the said ed, and the	GALAXY AGRICO EXPORTS LIMITED REGD. OFF / Factory : Jaikishan Ind. Estate, Survey No. 236, B/H Murlidhar Weigh Bridge, Veraval (Shapar). Dist. Rajkot. Tel. 02827-252676 Fax : 02827-254371 E-mail : info@galaxyagrico.com Web : www.galaxyagrico.com CIN: L01110GJ1994PLC021368	Offer	Problem	adodara 3900	Hotel, R C Du 307, Ph.0265- VEHICLE of below me	tt Road, Alkapuri, 2358115/2310555 ntioned vehicle in
the second s	noved within 7 days. For other qu 8980013758 or at nearest branc	n.	said Obligor(s)/Legal Heir(s)/Legal Rep respective copy from the undersigned on In connection with the above. Notice is	any working day during r	normal office hou	urs.	NOTICE OF AGM, E-VOTING AND BOOK CLOSURE	Sr. No.		Reserve Price	EMD Amount	Contact Person
Loan A/c No.	Mortgagor/Guarantor/ Khodabhai Dhanjibhai Darji S/O	Mortgaged Property Property No. 317,	Legal Heir(s)/Legal Representative(s) to respective Notice/s, the amounts indica together with further interest as detailed Column (D) till the date of payment and	pay to TCHFL, within 60 ted herein below again below from the respective for realisation, read with	0 days from the st their respecti e dates mention h the loan agree	date of the ive names, ed below in ement and	NOTICE is hereby given that 28" Annual General Meeting (AGM) of Members of the Company will be held on Friday, 30" September, 2022 at 11.00 a.m. At 236 Jai Kishan Industrial Estate, Behind Murkithar Weigh Bridge, Veraxal-Shapar (360024) Gajarat (India) to transact the ordinary and special businesses mentioned in the notice as contained in the Annual Report of the Company for the Financial Year 2021 – 22. Members of the	1.	KRISHNA MARKETING A/c No: 70437910000551 EICHER 40.35 E - 2015	Rs. 5,52,500.00	Rs.	Mr.
	Dhanjibhai Sendharam Darji (Borrower), Smt. Suniben Khodabhai Darji W/O Khodabhai Dhanjibhai Darji (Co-Borrower), Dhanjibhai Sendharam Darji S/O Sendharam Darji (Co-Borrower	Assessment Sr. No. 317 (Gamthan), Ta. & Dist Mehsana-384421, Gujarat Admeasuring 43.86 Sq. Mtr. & 11.24 Sq. Mtr.	other documents/ writings, if any, exer repayment of the loan, the following Se by the said Obligor(s) respectively. Loan Name of Obligor(s) Legal Account No. Heir(s) Legal Representative 9021602 Late Daxesh Avantilal Shah Through its Legal	cured Asset(s) have be	een mortgaged	Date of NPA	Company are hereby informed that the Company has completed the dispatch of Notice of the AGM. As per Section 106 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and amendments therete and Clause 358 of the Listing Agreement, the Company is pleased to provide its Members the facility to cast their vote electronically, through the remote e-voting services provided by Central Depository Service Limited (CDSL), on all resolution set forth in the Notice.	2.	GJ06AV6687 KRISHNA MARKETING A/c No: 70437910000551 EICHER 40.35 E - 2015 GJ06AV4878 KRISHNA MARKETING	Rs. 4,67,500.00		Raghavendra
L9001060100255559	& Mortgagor) Upendrakumar Amratlal	Milkat No. 2/16, Suthar	Heirs :- (A) Mrs. Hemabe Daxeshbhai Shah W/o Late Daxesh Avantilal				The date of completion of dispatch of Notices is <u>US<sup>2</sup> September</u> , <u>2022</u> . The Company has sent e-mail through CDSL along with details of Login ID and Passaword to the Members whose e-mail ids are available with the Company or have been provided by the Depositories.	3.	A/c No. 70437910000947 EICHER 40.35 E - 2015 GJ06AV9909	Rs. 5,52,500.00	Rs. 55,250.00	Parshi,
	Mevada S/O Amratlal Mevada (Borrower & Mortgagor), Smt. Manjulaben Upendrabhai Mevada W/O Upendrabhai Mevada (Co-Borrower),	Vas, Maharwada, Tehsil Unjha, Distt. Mehsana, Gujarat Admeasuring 21.76 Sq. Mtr.	Shah & (B) Mr. Rushabh Daxesh Shah Sio Late Daxesh Avantilal Shah, Mrs. Hemaben Daxeshbh Shah W/o Late Daxesh Avantilal Shah	ai			Pursuant to the 20 of the Companies (Management and Administration) Rules, 2014 and amendments thereto, the Members are provided with the following Information: 1.The remote e-voting period commences on Tuesday 27" September, 2022 (9:00 a.m. IST) and ends on Thursday 29" September, 2022 (5:00 p.m. IST). Remote e-voting by electronic mode shall not be allowed	4.	KRISHNA MARKETING A/c No. 70437910000947 EICHER 40.35 E - 2015 GJ06AV8847	Rs. 5,52,500.00	Rs. 55,250.00	Chief
19001060100638050	S/O/W/O/Do Bhaikhabhai (Borrower), Ramaben Bhikhabhai Bhutadiya (Co-	Property Situated At Plot No. 06, Milkat No. 869, Bhutadia Vas, Opp Primari School, Te	Description of the Secured Assets / Im the rights, piece & parcel of Immovable plan Ground Floor (parking upper floor proportionate share in the underneath la thereto of the premises/campus know	property bearing Plot/Fl admeasuring 183.95 S nd of the building and all vn as 'PRANGAN AP	lat no 101, as p Sq. Mtrs., undivi internal and external PARAMENT- 2	er passing ided share ernal rights 2°, in The	beyond 5:00 p.m. IST on 29" September, 2022. The voting rights of the members, entitled to participate in the remote e-voting process shall be in proportion to their share in the paid up equily share capital of the company as on the cut-off date i.e. Thursdey, 23" September, 2022. 2.Any person, who acquires shares of the Company and become member of the company after dispatched of the	5.	KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015 GJ06AV8685	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Manager,
	Borrower), Ramaben Bhikhabhai Bhutadiya	Vadgam, Dist Banaskantha, Gujarat Admeasuring 62.70 Square Metre	Kalamvadi Co-op Housing Society Sub residential use bearing R having T.P. So Village: Vasna & Elisbridge, Taluka: Bounded as follows:- East by: Kalamv Plot No.3, North by: Prangan Apartment	heme No. 26, Final Plot Ahmedabad, District: adi Society No 1, West I	no 1, Paiki Situa Ahmedabad o by: Side Mergin	ate at Moje of Gujarat. g after Sub	notice and holding shares as of the cut-off date i.e. Thursday 23" September, 2022, may obtain the lopin (0 and Password by sending a request all evoling/licital.co.in or RTA of the Company. However, if a person is already registered with COSL for e-voting, then existing user (0 and password can be used for casting vote. 1.The Members are also informed that:	6.	KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Canara
19001060100376336	S/O/W/O/Do Parshottambhai (Borrower), Vilashben Shingala (Co-Borrower), Rajendra Shingala (Co-Borrower) Hanshaben Rajendrabhai (Co-	Property Situated At House No B/46, Rameshwarpark Co.Op Housing Society Survey No 1067/68 Mouje Naroda, Tal-	TCHHL02 690001000 71718       Mr. Yogendra Giri, Mrs. Ranju Giri         Description of the Secured Assets / I All the rights, piece & parcel of Immova area Admeasuring is 52.50 Sq. Mtrs., a	ble property bearing Pl	/ Mortgaged Pr ot No. 41, Unit	2022 operties:- B of which	<ul> <li>a. The facility for voting through ballet paper shall be made available at the AGM and the members' attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to excersice their right at the meeting through ballet paper.</li> <li>b. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again in the meeting.</li> </ul>	7.	GJ06AV7767 KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015 GJ06AV7749	Rs. 4,67,500.00	Rs. 46,750.00	Bank, Alkapuri-II,
19001060121771141	Borrower) Purshottambhai Harjibhai Shingala Aaisa (Borrower), Salimkhan	Asarva, Ahmedabad Gujarat. Admeasuring 116.69 Square Metre Property Situated At	proportionate share in the underneath la premises/campus known as "Ghanshys Residential use bearing Revenue Surve Anjar, Distt Kutch, Bounded as Fo Road, North:- Plot No. 40 Paki Unit-A, S	um Park", constructed o y No.774. Situated at Vi llows: - East: Plot No.	n non-agricultur illage Varsame	ral land for edi, Taluka	<ul> <li>c. A Member as on the cut-off date shall only be entitled for availing the Remote e-voting facility or vote, as the case may be, in the AGM.</li> <li>d. A person, whose name is recorded in the register of the members or in the register of beneficial conners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avial the facility of remote e-voting /</li> </ul>	8.	KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015	Rs. 4,67,500.00	Rs. 46,750.00	Branch
	Jabirkhan Pathan (Co- Borrower), Reshmabanu Salimkhan Pathan (Co- Borrower)	House Gram Panchayat M No 42 113 S R No 145 Paiki Plot No A4 Residencial Deodar Deodar Banaskantha	TCHHL06 Mr. Ramesh kumar Balde 420001000 Bhai Rajput, Mrs. Kumud 03343 Ramesh Kumar Rajput Description of the Secured Assets / Im	as on 08-08-2022, an amount of Rs. 11,59,918/-		2022	Voting at the AGM through ballot paper. 1.The Notice of the AGM, along with the procedure for remote e-voting, has been sent to all the members by prescribed modes and the same is also available on the website of the company at www.galaxysgrice.com and on the website of Mational Securities Depository Limited at <u>https://www.evoting.cdsl.com</u>		GJ06AV7875 KHUSHI BULK CARRIER A/c No. 70437910000562 EICHER 40.35 E - 2015	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Mob.
		Gujarat Admeasuring 76.42 Sq. Yrd	the rights, piece & parcel of Immovable p of which area Admeasuring is 55.18 Sq share proportionate share in the underne	roperty bearing Flat No. Mtrs., along with the 19 eath land and all internal	C-402 on the Fo 9.87 Sq. Mtrs of and external rig	ourth Floor, f undivided hts thereto	2.In case of queries/grievances connected with e-voting, Members/Beneficial owner may contact COSL: Mr. Nilesh Dalwadi, email: ahmedabad0linkintime.coin, Phone No.: (079) - 2646 5179. or Members may contact Mr. Manoj		GJ06AV6858 KHUSHI BULK CARRIER A/c No. 70437910000562	Rs.	0       55,250.00         0       Rs. 42,500.00         0       42,500.00         0       42,500.00         0       46,750.00         0       46,750.00         0       Rs. 42,500.00         0       Rs. 46,750.00         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A         0       A     <	
L9001071019904482	Manishkumar Kalidas Parmar S/O Kalidas (Borrower), Sonalben Manishbhai Parmar W/O/D/O/S/O Manishbhai	Property Situated At Gram Panchayat Milkat No 125,Survey No 2926, Krushnnagar,	of the premises/campus known as "SAH land for Residential use bearing Final plo No.69 (Draft) (Land of Old Survey No.39 Chandkheda, Taluka Sabarmati, Old Ta District of Ahmedabad and Sub District of	t No. 391/1 & 394/1/1, of 1/1 and 394/1/1) situated aluka: Ahmedabad, City	Town and Planir d, lying and bein v West in the R	ng Scheme g at Mouje: Registration	Shah (Whole time Director) at the Registed Office of the Company at Jai Kishan Industrial Estate, Behind Munidhar Weigh Bridge, Veraxal-Shapar (360024) Gujarat (India) Phone : 02827-252676, email: <u>mike@galaxyagrico.com</u> Wis H. B. Kalaria & Associates, Chartered Accountant, Rajkot has been appointed as Scrutinizer for conducting the	10.	EICHER 40.35 E - 2015 GJ06AV5949 KHUSHI BULK CARRIER	4,25,000.00	42,500.00	09427314781
	(Co-Borrower), Parmar Manishkumar	Randheja,Near Dr. Ambedkar Statue, Vidhyapith Road,	East : Flat No. C-401, West: Flat No. C-4 "with further interest, additional Interest Demand Notices dated mentioned abov	03, North: Flat No. C-40 at the rate as more parti e, incidental expenses, o	5, South:-Block cularly stated in costs, charges e	k No. B. respective rtc incurred	remote e-voting process in a fair and transparent manner. Further notice is hereby given that pursuant to provisions of section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Clause 16 of the Listing Agreement, Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, September 24 <sup>4</sup> ,	11.	A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015 GJ06AV8865 KHUSHI BULK CARRIER	Rs. 4,25,000.00	and the second state of the second states	Email
19001060100649005	Kalpeshkumar Natvarlal Khandhara (Borrower),	Gandhinagar, Gujarat Admeasuring 900 Sqft Property Situated At House No-974/30,	till the date of payment and/or realization TCHFL as aforesaid, then TCHFL Asset(s)/Immovable Property(ies) unde Rules entirely at the risk of the said Obli the costs and consequences.	shall proceed again r Section 13(4) of the sa	nst the above aid Act and the	Secured applicable	A member entitled to attend and vote at the meeting is entitled to appoint proxy to attend and vote on a poll instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing proxy should be attend and vote on a poll instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing proxy should be attend and vote on a poll instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing proxy should be attend and vote on a poll instead of him/her and the proxy need not be a member of the company.	12.	A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015 GJ06AV8955	Rs. 4,67,500.00	1.197.63	cb17043@
	Natvarlal Parsotam Khandhara (Co-Borrower), Savitaben Natvarlal Khandhara (Co- Borrower)	Block-1, At-Saklana, Ta- Vadgam, Dist Banaskantha, Gujarat Admeasuring 705 Sq Ft.	The said Obligor(s)/Legal Heir(s)/Legal to transfer the aforesaid Secured Assisale, lease or otherwise without the p contravenes or abets contravention of the secure secu	et(s)/Immovable Proper rior written consent of ne provisions of the Act (	ty(ies), whether TCHFL. Any p or Rules made t	by way of erson who	d however be deposited at the registered office of the company sol less than forty-eight hours before the commencement of the meeting. By Order of the Board, GALAXY AGRICO EXPORTS LIMITED	13.	KHUSHI BULK CARRIER A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015 GJ06AV8478	Rs. 4,67,500.00	A	canarabank.com
Date : 03/09/20 Place : Ahmedat	022	Authorised Officer inance Bank Limited	shall be liable for imprisonment and/or pe DATE : 05-09-2022, PLACE: Ahmedabad For TATA	Sd	/- Authorise		Date: 05-09-2022 Manoj Harsukhlal Shah Place: Rajkot WHOLE-TIME DIRECTOR DIN : 02173383	1. D 2. D	ns of Yard Auction are as un ate and Time of EMD - 20.09 pate of Auction 20.09.2022, proposed Vehicles to be sold	9.2022 upto 0 Timings of A	uction at 5 p	m.
								can	uction for Vehicles will be do physically inspect the vehicle mum Reserve price).		A second second second second second	and the second secon

# ALL SAAALL EINIANICE DANK LIAATED

			In connection with the above. Notice is hereby given, once a	again, to the said	Obligor(s) /	ERVICE is busine along that WE bound framed Busines (IPBE of Business of the Parameter will be held on	No	Particulars	Price	Amount	Person
oan A/c No.	ame of Borrower/Co-Borrower Mortgagor/Guarantor/ Khodabhai Dhanjibhai Darji S/O Dhanjibhai Sendharam Darji	Mortgaged Property Property No. 317, Assessment Sr. No. 317	Legal Heir(s)/Legal Representative(s) to pay to TCHFL, within respective Notice/s, the amounts indicated herein below age together with further interest as detailed below from the respect Column (D) till the date of payment and/or realisation, read other documents/ writings, if any, executed by the said Ob	60 days from the ainst their respect tive dates mention with the loan agree	date of the live names, led below in eement and	NOTICE is hereby given that 28" Annual General Meeting (AGM) of Members of the Company will be held on Friday, 30" September, 2022 at 11.00 a.m. At 236 Jal Kishan Indushial Estate, Behind Murkthar Weigh Bridge, Veraxal-Shapar (360024) Gojarat (India) to transact the ordinary and special businesses mentioned in the notice as contained in the Annual Report of the Company for the Financial Year 2021 – 22. Members of the	1.	KRISHNA MARKETING A/c No: 70437910000551 EICHER 40.35 E - 2015 GJ06AV6687	Rs. 5,52,500.00	Rs.	Mr.
	(Borrower), Smt. Suniben Khodabhai Darji W/O Khodabhai Dhanjibhai Darji (Co-Borrower), Dhanjibhai Sendharam Darii S/O	(Gamthan), Ta. & Dist Mehsana-384421, Gujarat Admeasuring 43.86 Sq. Mtr. & 11.24 Sq. Mtr.	repayment of the loan, the following Secured Asset(s) have by the said Obligor(s) respectively.           Loan         Name of Obligor(s) Legal         Total Outstanding I           Account No.         Heir(s) Legal Representative(s)         Rs. as on below Da           9021602         Late Daxesh Avantilal         as on 24-08-202	been mortgaged Due Date of tes Demand Notice	Date of NPA	Company are hereby informed that the Company has completed the dispatch of Notice of the AGM. As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and amendments thereto and Clause 358 of the Listing Agreement, the Company is pleased to provide its Members the facility to cast their vote electronically, through the remote e-voting	-	KRISHNA MARKETING A/c No: 70437910000551 EICHER 40.35 E - 2015 GJ06AV4878	Rs. 4,67,500.00	Rs. 46,750.00	Raghavendra
	Sendharam Darji (Co-Borrower & Mortgagor)		Shah Through its Legal an amount of Heirs :- (A) Mrs. Hemaben Rs. 12,78,154/ Daxeshbhai Shah W/o		2022	services provided by Central Depositary Service Limited (CDSL), on all resolution set forth in the Notice. The date of completion of dispatch of Notices is <u>05<sup>°</sup> September</u> , <u>2022</u> . The Company has sent e-mail through CDSL along with details of Login ID and Password to the Members whose e-mail ids are available with the		KRISHNA MARKETING A/c No. 70437910000947 EICHER 40.35 E - 2015	Rs. 5,52,500.00	Rs. 55,250.00	Parshi,
	Mevada S/O Amratlal Mevada (Borrower & Mortgagor), Smt. Manjulaben Upendrabhai Mevada W/O Upendrabhai	Milkat No. 2/16, Suthar Vas, Maharwada, Tehsil Unjha, Distt. Mehsana, Gujarat Admeasuring 21.76 Sq. Mtr.	Late Daxesh Avantilal Shah & (B) Mr. Rushabh Daxesh Shah S/o Late Daxesh Avantilal Shah, Mrs. Hemaben Daxeshbhai Shah W/o Late Daxesh Avantilal Shah			Company or have been provided by the Depositories. Pursuant to the 20 of the Companies (Management and Administration) Rules, 2014 and amendments thereto, the Members are provided with the following Information: 1.The remote e-voting period commences on Tuesday 27" September, 2022 (9:00 a.m. IST) and ends on Thursday 29" September, 2022 (5:00 p.m. IST). Remote e-voting by electronic mode shall not be allowed	4.	GJ06AV9909 KRISHNA MARKETING A/c No. 70437910000947 EICHER 40.35 E - 2015 GJ06AV8847	Rs. 5,52,500.00	Rs. 55,250.00	Chief
L9001060100638050	Dilipkumar Chaudhary S/O/W/O/Do Bhaikhabhai (Borrower), Ramaben Bhikhabhai Bhutadiya (Co-	Property Situated At Plot No. 06, Milkat No. 869, Bhutadia Vas, Opp Primari School, Te Vadgam, Dist	Description of the Secured Assets / Immovable Properties the rights, piece & parcel of Immovable property bearing Plo plan Ground Floor (parking upper floor) admeasuring 183.9 proportionate share in the underneath land of the building and thereto of the premises/campus known as 'PRANGAN	VFlat no 101, as p 5 Sq. Mtrs., undiv all internal and ext APPARAMENT-	ber passing vided share ternal rights 2°, in The	beyond 5:00 p.m. IST an 29" September, 2022. The voting rights of the members, entitled to participate in the remote e-voting process shall be in proportion to their share in the paid up equily share capital of the company as on the cut-off date i.e. Thursday, 23" September, 2022. 2.Any person, who acquires shares of the Company and become member of the company after dispatched of the	5.	KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015 GJ06AV8685	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Manager,
0001060100276226	Bhikhabhai Bhutadiya	Banaskantha, Gujarat Admeasuring 62.70 Square Metre	Kalamvadi Co-op Housing Society Sub Plot no 2 constricter residential use bearing R having T.P. Scheme No. 26. Final P Village: Vasna & Elisbridge, Taluka: Ahmedabad, Distri Bounded as follows:- East by: Kalamvadi Society No 1, We Plot No.3, North by: Prangan Apartment Front Margin and Ros	lot no 1, Paiki Situ ct: Ahmedabad ( st by: Side Mergin	ate at Moje of Gujarat. Ig after Sub	notice and holding shares as of the cut-off date i.e. Thursday 23" September, 2022, may obtain the lopin ID and Password by sending a request all evolang@cdsl.co.in or HTA of the Company. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote. 1.The Members are also informed that:		EICHER 40.35 E - 2015	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Canara
	S/O/W/O/Do Parshottambhai (Borrower), Vilashben Shingala (Co-Borrower), Rajendra Shingala (Co-Borrower) Hanshaben Rajendrabhai (Co-	Property Situated At House No B/46, Rameshwarpark Co.Op Housing Society Survey No 1067/68 Mouje Naroda, Tal-	TCHHL02 690001000 71718       Mr. Yogendra Giri, Mrs. Ranju Giri       as on 09-08-202 an amount of Rs. 8,86,512-         Description of the Secured Assets / Immovable Propertie All the rights, piece & parcel of Immovable property bearing area Admeasuring is 52.50 Sq. Mtrs., along with the 125.64	es / Mortgaged P Plot No. 41, Unit	2022 roperties:- B of which	<ul> <li>a. The facility for voting through ballot paper shall be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to excersice their right at the meeting through ballot paper.</li> <li>b. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again in the meeting.</li> </ul>	7.	GJ06AV7767 KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015 GJ06AV7749	Rs. 4,67,500.00	Rs. 46,750.00	Bank, Alkapuri-II,
L9001060121771141	Harjibhal Shingala Aaisa (Borrower), Salimkhan	Asarva, Ahmedabad Gujarat. Admeasuring 116.69 Square Metre Property Situated At	proportionate share in the underneath land and all internal and premises/campus known as "Ghanshyam Park", constructed Residential use bearing Revenue Survey No.774, Situated a Anjar, Distt Kutch, Bounded as Follows: - East: Plot N Road, North:- Plot No. 40 Paki Unit-A, South: Plot No.42.	d external rights th d on non-agricultu t Village Varsame	ereto of the ral land for edi, Taluka	<ul> <li>c. A Member as on the cut-off date shall only be entitled for availing the Remote e-voting facility or vote, as the case may be, in the AGM.</li> <li>d. A person, whose name is recorded in the register of the members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avial the facility of remote e-voting /</li> </ul>		KRISHNA MARKETING A/c No. 70437910000858 & 70431400000219 EICHER 40.35 E - 2015	Rs. 4,67,500.00	Rs. 46,750.00	Branch
	Borrower), Reshmabanu Salimkhan Pathan (Co- Borrower)	House Gram Panchayat M No 42 113 S R No 145 Paiki Plot No A4 Residencial Deodar Deodar Banaskantha	TCHHL06         Mr. Ramesh kumar Baldev         as on 08-08-202           420001000         Bhai Rajput, Mrs. Kumud         an amount of           03343         Ramesh Kumar Rajput         Rs. 11,59,918/           Description of the Secured Assets / Immovable Properties         the rights, piece & parcel of Immovable property bearing Flat M	/ Mortgaged Pro	2022 perties:-All	Voting at the AGM through ballot paper. 1.The Notice of the AGM, slong with the procedure for remute e-voting, has been sent to all the members by prescribed modes and the same is also available on the website of the company at www.galaxyaprice.com and on the website of National Securities Depository Limited at <a href="https://www.evoting.cdsl.com">https://www.evoting.cdsl.com</a>	110	GJ06AV7875 KHUSHI BULK CARRIER A/c No. 70437910000562 EICHER 40.35 E - 2015 GJ06AV6858	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Mob.
Khodabhai Dhanjibhai Darji (Co-Borrower), Dhanjibhai       C         Sendharam Darji (Co-Borrower & Mortgagor)       M         9001060100255559       Upendrakumar Amratlal       M         Mevada \$/O Amratlal Mevada (Borrower & Mortgagor), Smt.       M         9001060100638050       Dilipkumar Chaudhary S/O/W/O/Do Bhaikhabhai       M         9001060100638050       Dilipkumar Chaudhary S/O/W/O/Do Bhaikhabhai       M         9001060100376336       Pareshbhai Bhutadiya (Co- Borrower), Ramaben Bhikhabhai Bhutadiya       M         9001060100376336       Pareshbhai Shingala S/O/W/O/Do Parshottambhai (Borrower), Vilashben Shingala (Co-Borrower), Rajendra Shingala (Co-Borrower)       M         9001060121771141       Aaisa (Borrower), Salimkhan I abirkhan Pathan (Co- Borrower) Purshottambhai Harjibhai Shingala       M         9001071019904482       Manishkumar Kalidas Parmar S/O Kalidas (Borrower), Salimkhan I abirkhan Pathan (Co- Borrower), Parmar Manishkumar       M         900106012077014904482       Manishkumar Kalidas Parmar S/O Kalidas (Borrower), Salimkhan I (Co-Borrower), Parmar Manishkumar       M         9001060100649005       Kalpeshkumar Natvarlal (Co-Borrower), Savitaben Natvarlal Parsotam Khandhara (Co- Borrower), Savitaben       M         9001060100649005       Kalpeshkumar Natvarlal Khandhara (Borrower), Savitaben Natvarlal Parotam Khandhara (Co- Borrower), Savitaben       M	Gujarat Admeasuring 76.42 Sq. Yrd Property Situated At Gram Panchayat Milkat	of which area Admeasuring is 55.18 Sq. Mtrs., along with the share proportionate share in the underneath land and all inter of the premises/campus known as "SAHAJ RESIDENCY", or land for Residential use bearing Final plot No. 391/1 & 394/1/1, No.69 (Draft) (Land of Old Survey No.391/1 and 394/1/1) situa	<ul> <li>19.87 Sq. Mtrs o nal and external rig instructed on non- of Town and Plani</li> </ul>	of undivided ghts thereto agricultural ing Scheme	2.In case of queries/grievances connected with e-voting, Members/Beneficial owner may contact COSL: Mr. Nilesh Dalwadi, email: ahmediabad/Olinkintime.coin, Phone No.: (079) - 2646 5179. or Members may contact Mr. Manoj Shah (Whole time Director) at the Registed Office of the Company al Jai Kishan Industrial Estate, Behind Muridhan Weigh Bridge, Veraval-Shapar (360024) Gujanat (India). Phone : 02827-252678, email: mike@galaxyagrico.com		KHUSHI BULK CARRIER A/c No. 70437910000562 EICHER 40.35 E - 2015 GJ06AV5949	Rs. 4,25,000.00	Rs. 42,500.00	09427314781	
	W/O/D/O/S/O Manishbhai (Co-Borrower), Parmar	No 125, Survey No 2926, Krushnnagar, Randheja, Near Dr. Ambedkar Statue, Vidhyapith Road,	Chandkheda, Taluka Sabarmati, Old Taluka: Ahmedabad, O District of Ahmedabad and Sub District of Ahmedabad-2 (Wa East : Flat No. C-401, West: Flat No. C-403, North: Flat No. C- with further interest, additional Interest at the rate as more particular	City West in the F daj). Bounded as 405, South:- Bloc articularly stated in	Registration Follows: - k No. B. h respective	M/s H. B. Kalaria & Associates, Chartered Accountant, Rajkot has been appointed as Scrutinizer for conducting the remote e-voling process in a fair and transparent manner. Further rotice is hereby given that pursuant to provisions of section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Clause 16 of the Listing Acreement,	11	KHUSHI BULK CARRIER A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015 GJ06AV8865	Rs. 4,25,000.00	Rs. 42,500.00	Email
0001050100540005	Wata and the same Minister of the	Gandhinagar, Gujarat Admeasuring 900 Sqft	Demand Notices dated mentioned above, incidental expense till the date of payment and/or realization, if the said Obligor(s) TCHFL as aforesaid, then TCHFL shall proceed ag Asset(s)/Immovable Property(ies) under Section 13(4) of the	shall fail to make ainst the above	payment to e Secured	Register of Weinters and Stare Transfer Books of the Company will remain closed from Saturday, September 24°, 2022 to Friday, September 39°, 2022. (Both days inclusive) for the said AGM of the Company. A member entitled to attend and vote at the meeting is entitled to appoint proxy to attend and vote on a pol	12	KHUSHI BULK CARRIER A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015	Rs. 4,67,500.00	Rs. 46.750.00	cb17043@
19001060100649005	Khandhara (Borrower), Natvarlal Parsotam Khandhara (Co-Borrower), Savitaben Natvarlal Khandhara (Co-	Property Situated At House No-974/30, Block-1, At-Saklana, Ta- Vadgam, Dist Banaskantha, Gujarat Admeasuring 705 Sq Ft.	Rules entirely at the risk of the said Obligor(s)/Legal Heir(s)/I the costs and consequences. The said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) are to transfer the aforesaid Secured Asset(s)/Immovable Prop sale, lease or otherwise without the prior written consent contravenes or abets contravention of the provisions of the A	egal Representat prohibited under to erty(ies), whether of TCHFL. Any p oct or Rules made	tive(s) as to the said Act r by way of person who	instead of him/her and the proxy need not be a member of the company. The instrument appointing proxy shoul d however be deposited at the registered office of the company sol less than forty-eight hours before the commencement of the meeting. Pur Ourdear of the Registered	lŀ	GJ06AV8955 KHUSHI BULK CARRIER A/c No. 70437910000866 EICHER 40.35 E - 2015 GJ06AV8478	Rs.	Rs.	canarabank.com
		Authorised Officer inance Bank Limited	shall be liable for imprisonment and/or penalty as provided und DATE : 05-09-2022, PLACE: Ahmedabad For TATA CAPITAL HOUS	Sd/- Authorise	d Officer LIMITED	Date: 05-09-2022 Manoj Harsukhlal Shah	1. 1 2. 1 3. 1 4. 7	rms of Yard Auction are as un Date and Time of EMD - 20.00 Date of Auction 20.09.2022, Proposed Vehicles to be sold Auction for Vehicles will be do a physically inspect the vehicle himum Reserve price).	9.2022 upto 04 Timings of An on "as is where one in front of re	uction at 5 p e is" basis. espective Vel	hicles where buye

	a nogen tel contraction to			
Loan ccount No.	Name of Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s)	Total Outstanding Due Rs. as on below Dates	Date of Demand Notice	Date of NPA
021602	Late Daxesh Avantilal Shah Through its Legal Heirs :- (A) Mrs. Hemaben Daxeshbhai Shah W/o Late Daxesh Avantilal Shah & (B) Mr. Rushabh Daxesh Shah S/o Late Daxesh Avantilal Shah, Mrs. Hemaben Daxeshbhai Shah W/o Late Daxesh Avantilal Shah	as on 24-08-2022, an amount of Rs. 12,78,154/-	24-08-2022	10-May, 2022

	Mr. Yogendra Giri, Mrs. Ranju Giri	as on 09-08-2022, an amount of Rs. 8,86,512/-	09-08-2022	08-July, 2022
All the right area Admea proportional premises/ca Residential Anjar, Disti	n of the Secured Assets / Imm s, piece & parcel of Immovable asuring is 52.50 Sq. Mtrs., alor te share in the underneath land impus known as "Ghanshyam use bearing Revenue Survey f t Kutch, Bounded as Follo n:- Plot No. 40 Paki Unit-A, Sou	e property bearing Pic ng with the 125.64 Sq and all internal and ex Park", constructed or No.774, Situated at Vil ws: - East: Plot No. 4	of No. 41, Unit Yard of undivi- ternal rights the non-agricultu lage Varsame 68, West : 6.1	B of which ided share areto of the ral land for di, Taluka 0 mtr Vide
	Mr. Ramesh kumar Baldev Bhai Raiput, Mrs. Kumud	as on 08-08-2022, an amount of	08-08-2022	04-July, 2022

financialexp.epapr.in





# NEFT Details: Canara Bank, Alkapuri II Branch, A/c No. 209272434, IFSC-CNRB0017043.

DD: Favouring Canara Bank, payable at Vadodara.

failing which the EMD deposited stands forfeited.

Bid once approved, Buyer can not back out for whatever may be the reason. Bank reserve the right to cancel or postpone Yard auction without prior notice.

5. Balance of successful BID amount to be remitted within 15 working days

Date: 05.09.2022- Place: Vadodara

Authorised Officer - Canara Bank

Ahmedabad

### સોમવાર તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૨



સુરત	2							સિટી				ાા.૫ સપ્ટેમ્બ		ා යා දේශ සංකා වැන්න සංකා වැන්න සංකා දේශ
ગુજરાત્	માંઓલ	ઇન્ડિ	યા્જે	લઞ્	<u> </u>	યોની પરિપ	ષદનો	સાયબ	२ ईरि	નો શિક	ોર સે મેનેજર ત <b>ઇ</b> ટ	<b>રતની ર</b> નોકરી કરે છે.તેર	ار المعلقة المعلمة المعلمة المحلمة محلمة المحلمة محلمة المحلمة محلمة المحلمة محلمة المحلمة محلمة محلمة محلمة ومحلمة محلمة محلمة محلمة محلمة محلمة محلمة محلمة محل	ન બેંકના ચીક મેનેજર જ બન્ય મને બીજા 2.૨૨ લાખ પશ પરત હતું.જેથી રાકેશ સિન્હાએ આ બાબ નહોતા રાકેશ સિન્હાએ દલાલ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં રૂ.2.૨
		ાસમા	<b>H</b>	<b>स् २</b> धन्डिया ।	<b>ોક્ટ લાવ</b> પ્રઝન ડ્યુટી મીટ- 2022'	શે:અમિત <sup>માં તમામ</sup> જેલોમાં અત્યા <sup>હ</sup>	<b>પ્રાદિ</b> વૃત્તિક સવિધાઓ	બનતા હોય છે.અ ગાહકોને સાયબ	ાને હમેશા બેંક ગ્રકો ૮ શી બગાવ	પોતાના સમય ગ માટે કર્યો	ા આગાઉ એક હતો અને પોત	વ્યક્તિએ તેમેને ફ મની ઓળખ દલ	ોન સ્ટ્રીટમાં ાલ કા લ	ાં તપાસ કરાવી તો તેમાં તે ચેતન લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હ ર્યુ કે અક્તરાત સરલા પકોર્મન્સ કાઈબર્સ લિમીટે
અમો જાહે આપનાર	કેર ચેતવણી 'ઓલ હિંમતભાઈ 2022'નો	ઇન્ડિયા પ્રિઝન ો ટ્રાન્સસ્ટેડિયા,	ડ્યુટી મીટ- અમદાવાદથી	૧૦૩૧	મધિકારીઓ-કર્મચારીઓ વિલિ માં ભાગ લઈ રહ્યા છે. મિટ	નો અમિત શાહે કહ્યું હતું કે,	નનો ઉલ્લેખ કરી દરેક રાજ્ય અને	કરતી હોય છે.પ્ મેનેજર પશ સાય	શ યુનિયન બેકન્ બરફ્રોડ કરતી ટે -	ના ચીફ અને ોળકીનો કારસં	તમે જો ફ્યુચ ાો તો સારો ન 	ર ઓપ્શનમા રોક ાફો થશે તેવી વા	ાણ યા રહે ાતો શ્યામ	<b>રજિ.ઓફિસ:</b> સવેંન.પ૯/૧/૪,આમલીપીપરીશાઈન્ડસ્ટ્રીચલએસ્ટેટ,સિલવાસા-૩૯૬૨૩૦( 4 શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી) <b>ટે.નં.</b> ૦૨૬૦-૩૨૯૦૪૬७, <b>ફેકસ :</b> ૦૨૬૦-૨૬૩૧૩ <b>ઇ-મેઈલ :</b> investors@sarlafibers.com વેબ સાઈટ : www.sarlafibers.com
	ણ કરવાની કે, ા કહ્યામાં નથી. રંબમાંથી અને <b>દેશના</b>	ા ૧૯ રાજ્ય	ો અને કેન્ડ	દ્રશાસિત	રાવતા કેન્દ્રીય ગૃહમંત્રી જણા 1 <b>પ્રદેશના એક હજા</b> 4 અપર્ધનાં નામ્સ છે	વીડિયો કોન્ફરન્સની સુવિ ર એ સમયની માંગ છે. ન	વેધા હોવી જોઇએ ારકોટિકસ તેમજ ારાવતા કેદીઓને	સાયબર ફ્રોડ ટ	રોળકીએ મેને	જર રાકેશ સિં	ાંન્હા પાસેથી	૨.૨૨ લાખ ઉ	કસેટી લીધા	આથી નોટીસ આપવામાં આવે છે કે સરલા પડ્ડોર્મન્સ ફાઈબર્સ લિમીટેડ <b>(ધ કંપ</b> ની સ્ટમી વાર્પકિ સાધારણ સભા <b>(ઝેજીએમ)</b> બુધવાર તા.સ્ટમી સપ્ટેમ્બર,સ્ટસ્ટના બપોર્ટ ૦૧.૦૦ કલાકે (ભારતીથ સ્ટાન્ડર્ડ સમય મુજબ વિડીચો કોન્ફ્સ્ટર્સીંગ (વી. અધાર આડિગો-તીપ્સથલ પ્રીન્લ (પરોપ્ટેનીએમ) ડાવા રોબલાર છે જેમાં ટ્રન્ડા મેગેન્ઝર્મ
છીએ. જેથી અમોના પુત્ર નિકુ નામે નાણાકીય કે કોઈ પણ પ્ર કરવો નહીં અને જો કોઈ વ્યવ જવાબદારી અમારી કે અમાર	ાકારનો વ્યવહાર હાર કરે તો તેની અમિત ક	શાહે જણાવ્યું કે,	જેલ પ્રશાસન	હતું કે,	<b>ધ સ્પર્ધામાં ભાગ લે</b> વડાપ્રધાન મોદીએ અગ ોવા જેલ મેન્યુઅલના બદલે બ	<ul> <li>પ્રમાણમાં કેદીઓ હોય </li> <li>નથી ત્યારે જેલ નિયંત્રા</li> </ul>	તે સ્થિતિ ઉચિત શ માટે વૈજ્ઞાનિક	શિકાર બની ગય લાખની ઠગાઈ થ આ અંગે જ મુજબ,અડાજણના	ઇ હતી. ક્રાણવા મળતી	્ વિગતો ટુકડે	ોએ છીએ તેમ ૨.૧૦ લાખનું	કહ્યું હતું અને ટુ રોકાણ કરાવ્યું હ	ડ્રકડે મંદિર હતું પાસે	වා එහින්වා ජංග්යා වාසිය දුන්වේ සංකාශය සං සංකාශය සංකාශය සංකාශය සංකාශය සංකාශය ස
નહીં. લિ. હિંમતભાઈ નાગર્ મારી મારફ્ત, રોનક એમ. કુકડીયા	<b>ષ્ટ્રભાઇ ગજેરા</b> છે, ત્યારે કેદીઓનું (એડવોકેટ) જરૂરી છે	. જેલ સુધારણા ચ , પુનર્વસન થાય 9. વર્તમાન કેન્દ્ર	અને તેના દ્વારા . તે એટલું જ સરકારે જેલ	2016માં ૨ કર્યું છે. ૧ કેન્દ્રશાસિલ	મોડેલ જેલ મેન્યુઅલ કાર્યાન્વિ ક્ષે કે દેશના 11 રાજ્યો અ ત પ્રદેશોએ તેને અપનાવ્યું	ર્યત છીએ તેમ એમણે જણાવ્ ાને બિરદાવતા તેમણે કહ્યું હ છે. પોલીસ રિસર્ચ એન્ડ ડે	યું હતું. આ મીટને કતું કે, બ્યુરો ઓફ વલપમેન્ટ એકમ	ુુુુુુુ , આવેલા વિમલ રહેતા રાકેશ ચંડીગઢની યુનિય	હેક્ઝાગોન ફ્લ શ્યામાપ્રસાદ	લેટ્સમાં વધાર સિન્હા બીજા	શે તો નુકશાન ા 2.૨૨ લાખ	નહિ થશે તેમ કહે પડાવી લીધા હ	ીંને થાષા તા. હોવાનું	; બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના તા.૧૨મી મે,૨૦૨૦, ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ અને ૧૩૫ - ૨૦૨૨ના ના સરકરાવર નં SEBI/HO/CED/CMD2/CIR/b/2020/79, SEBI/HO/C
૩૦૨, રેડ ટર્નિંગ પોઈન્ટ પોલીસ ચોકી સામે, એલ.એ હિંહે	. માતાવાડી સુધારણા		૬કી 'ઓલ	એકટ લા	તર આગામી 6 માસમાં મોરે વશે અને તેના પગલે દેશ થ <b>, સુરત</b>		ASPIRE	મોતીલાલ ઓસવાલ	ਟ।੫૨, ૨૯િમતુલ્લ। Email ∹ info@	<b>ફાઇનાન્સ</b> ાહ સચાણી રોડ, ર @ahfcl.com. ાષ સ્થાવર મિલકત	એસટી ડેપોની સા 1:-U65923MH2013I	PLC248741	<b>ès</b> - 400 025.	ਕਿਸੀਣੇડ (NSDL) ਫ਼ਾਂਦਾ ਪ੍ਰਦੀ ਪਾਤਕਾਸਾਂ આਕશੇ. ਕਾਰੁ ਪਤਕਾ ਸ਼ಕੰਤੂਕਰੇ, ਐਲੂਐਸਰੀ ਗੀਟੀਸ਼ ਅਰੇ ਤੱਪਰੀਗੇ ਕਪ ਟਰਣ੧-ਦਣਗੇਗਪੱਛਿ ਅਣੇ ਕੇ ਗੁਲਬੇ ਰੇਸਗਾਂ ਓਸੇਕ ਐਡ੍ਰੇਸ਼ ਰੇਸਗਾਂ ਤੀਪੀਸ਼ੀਟਈ ਪਾਣੀਇਪੇਕਟ(ਜ),ਤੱਪਰੀਗਾ ਵਕਿ ਅਰੇ ਟਾਲਜ਼ਤ ਐਕਟ( ਆਟਟੀਐ) ਕੇਸਣੇ, ਕਿੱਤ ਓਰਟਾਓਸ ਓਨਿੰਡਾ ਸਾਓਕੇਟ ਕਿਸੀਣੇਤ ਗੱਛਾਕਯਾ ਣਵੇ ਰੇਸਰੇ ਸਾਂਸ ਓਕੇਡਟ੍ਰੇਰਿਤ ਸੇਤਿਈ ਸੇਤਿਕਰਸਾਂ ਆਰਵੇ ઉਪਣ ਕਾਗਰੇਕਾ ਐਸ
આથી, અહીં અંત્રે જાહેર જનત આથી, અહીં અંત્રે જાહેર જનત પ્ર <b>ત્યેક્ષ કબજા</b> માં રહેલી મિલક છે'' ના આધાર પર નીચે દર્શાવ ઈ-ઓકશન <b>તા. ૦૬.૧૦.૨</b>	તાને તથા વ્યક્તિગત રીતે લોનક ત <b>તા. ૦૬.૧૦.૨૦૨૨</b> ના રો૧ નેલ જામીનપાત્ર, લોન પરનું વ્યા ૨ <b>૦૨૨</b> ના રોજ https://sarfa	૪ સદર બેંકના અધિકૃ ાજ, અન્ય ખર્ચા અને aesi.auctiontiger.r	નદાર(રો) ને નીચે કુત અધિકારીએ સદ લાગુ પડતા ચાર્જન net પર <b>૧૧.૦૦</b>	વર્ણવવામાં આ દરહું મિલકત '' તી વસૂલાત માટે <b>થી ૦૧.૦૦</b>	ાવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક્ગ જ્યાં છે, જેમ છે'' અને ''જ્યાં છે, ર સાકેતીક/પ્રત્યેક્ષ કબજો તીધો દે દરમિયાન ચોજવામાં આવનાર દે	જ્ર સકારાત્મક પ્રતિસ્પધો ૭. અને ખેલભાવના ૭. વિકસાવવાનું માધ્યમ	ફાઇનાન્સિચલ એ (12) ની સાથે સિ નીચે દર્શાવેલ ખાત નોટીસ(સો) ની મ દેવાદા૨ (૨ો) નોટં	એસ્પાચર હોમ ફાઇના સ્લેટ્સ એન્ડ એન્ફોર્સ ક્લુરિટી ઇન્ટરેસ્ટ ( એ ાની સામે દર્શાવેલ તા ળ્યાની તારીખથી દિવસે રીસમાં જણાવ્યા મુજબ ાં આવે છે કે સદર એ	ન્સ કોર્પોરેશન લિ. ોન્ટ ઓફ સિક્યુરિ ન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ટીઓએ દેવાદારોને ૧ ૬૦માં ચૂકવી દેવ ની ૨કમ ચૂકવવામાં	ના અધિકૃત અધિ શ્ટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002 રૂલ 3 ને વંત્ ડિમાન્ડ નોટિસ ( ા જણાવવામાં આવ્ટ્ i નિષ્ફળ જતાં દેવ	કારીએ સિક્યુરિટ 2 2002 ના રૂલ 8 ચાણે લેતાં આપવા સો) મોકલી આપી યું હતું. ાાદા૨ (૨ો) ને ખાર	ાઈઝેશન એન્ડ રિકન્સ (1) નું પાલન કરતા માં આવેલી સત્તાનો ઉ તેમાં જણાવ્યા મુજબ સ અને જનતાને આ	અને ખંડ 13 કેપચોગ કરતાં નની રકમ આ બાહેર નોટીસ	અને સેબીના સર્કચુલરો મુજબ એજીએમની નોટીસ અને વર્ષ ૨૦૨૧-૨૨નાવાર્ષકિ અહેવા( કોઈ વાસ્તવિક નકલ સભ્યોને મોકલવામાં નહીં આવે.સભ્યોએ નોંધ લેવી કે એજીએ નોટીસ અને વર્ષ ૨૦૨૧-૨૨નાવાર્ષકિ અહેવાલકંપનીની વેબ સાઈટ <u>www.sarlafibers.c</u> અને સ્ટોક એસ્ચેન્જ, સ્ટોક એસ્ચેન્જ- બીએસઈ લિમીટડની વેબ સાઈટ <u>www.sseind</u> <u>com</u> અને નેશનલ સ્ટોક એસ્ચેન્જ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ <u>www.nseindia.com</u> પણ ઉપલબ્ધ છે. સભ્યો એજીએમમાં માત્ર વીસી/ઓએવીએમ દ્વારા જ ભાગ લઈ શક્શેઅથવા હાજર શક્શે એજીએમમાં બેડાવા માટેની સુચનાઓ એજીએમ નોટીસમાં આપવામાં આવી છે.જે સ
નીચે દર્શાવેલ છે.	પર પણ મિલકતાના ઠરાજી કરવ  વાઢનોની વિગત∕રજી. વર્ષ		કતના સપૂણા વગત અનામત		મત, ઇએમડી અને પઝેશનનો પ્રકા વાદન જોવાનું સ્થળ	ર બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ છકી ઓલ	સહી કરનારે નીચે આથી દેવાદાર ( રો	દર્શાવેલ પ્રત્યેક ખાતા ।) ને ખાસ અને જનત કરવો નહીં કેમ કે અ	ની સામે દર્શાવેલ ત ાને આ જાહેર નોટી	ારીખના રોજ નીચે ોસ મારફ્તે ચેતવર્ણ	જણાવેલી મિલ્કત 11 આપવામાં આવે	( તો ) નો કબ્બે લીધ છે કે નીચે જણાવેલી	ો છે. મિલ્કત (તો)	એજીએમમાં વીસી/ઓએવીએમ સુવિંધાદ્વારા જોડાશે તેમની ગણતરી કંપનીઝ એકટ ૨૦૧ ખંડ ૧૦૩ હેઠળ કોરમ માટે કરવામાં આવશે. ભોર્ડે ફાઈનલ ડીવિડન્ડ પ્રતિ શેર રૂ.ર/- અથવા ૨૦૦ ટકા રૂ.૧/- ના ૮૩,૫૦૩ ઇક્વિટી શેર્સને પ્રતિ શેર આપવાની ભલામણ તા.ર૫મી મે,ટ૦૨૨ના રોજ મળેલી મિર્ટ
ક્રમ શાખાનું નામ ૧ જંબુસર	متواها الإعرار <b>حق. 44</b> MESSY 241 – TRACTOR - 2017	<b>૨જીસ્ટ્રેશન નં.</b> GJ 16 BN 8845	रडभ 3,25,000.00	ઇએમકી 32,500/-	મહેંદીવાલા એન્ટરપ્રાઇઝ, બસ કેપોની સામે, જંબુસર.	કુતુ ક, આ છકા આલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ગુજરાતમાં યોજાઇ		ને કબજો છે. ારવામાં આવે છે કે સદર <b>તેન્ટ નંબર/ દેવાદાર /</b>		ી પેટા ખંડ (8) અનુર કબજો લીધા				કરી હતી બો એભુએમમાં એને મંભુરી મળે તો એનું ચુકવણું થશે જેમાં ટેક્ષ એટ સોર્સની ક થશે.જે સભ્યો પાસે છેલ્લી તારીખ બુદાવાર,રવમી સપ્ટેમ્બર,ર૦રરના રોજ કંપનીના હોય(ડીમટીરીચલાઈઝડ અથવા ફિઝીકલ શેર્સ ) તેમને જ ડીવિડન્ડ રહમી ઓક્ટોબર,ર
ગોઃ૯૦૯૯૦૦७૦૨૧ ૨. કારેલી ગોઃ૯૦૯૯૦૦७૦૦૩	H HONDA HUNK - BIKE -2013	GJ 16 BE 3220	3000.00	300/-	મોઃ ૯૯૨૫૦૨૨૭૫૦ મુ. ધોર, તાલુકોઃ ઉમરેઠ, જીલ્લોઃ આણંદ મોઃ ૯૯૨૪૮૮૫૬૨७	રહી છે તે ગૌરવની વાત છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ,	<u>ਗ</u> . <b>સહદેવાદા</b> 1. LXSUR0 ਦਾਤੇશਤੁਸਾ	થ/ જામીનદારોનું નામ 0315-160020315 ૨ મનુભાઈ પોપટાણી ાઈ પોપટભાઈ પોપટાણી	તારીખ અને રકમ	<mark>તારીખ</mark> <b>)1-09-2022</b> ફલેટ ગોદા	ટ નં.ડી-૧૦૩,૫૯ેલ ાવરી ઈન્ડસ્ટ્રીઝન	મૂ <b>કેલી સંપત્તિ(ઓ)નું</b> લા માળે, સાંઇ દર્શન ી સામે, બ્લોક નં સિવાણ, સુરત ગુજર	1 રેસીડેન્સી, ૧૬૪, પ્લોટ	પહેલા તેમને મોકલવામાં આવશે અથવા ખાતામાં જમા કરવામાં આવશે. સત્યોને આથી જાણ કરવામાં આવે છે કે ફાઈનાન્સ એકટ,ર૦૨૦ને ધ્યાને રાખી કંપ ડીવિડન્ટની ચુકવણી સમયે ઈન્કમ ટેક્ષ એકટ,૧૯૬૧ (ધ એકટ) મુજબ ટેક્ષ એટ નિર્ધાર્ટીત દરે કપાત કરવાની રહેશે.જેથી ટીડીએસની પૂર્તતા માટે સભ્યોને તેમના નિ દરજજા,પાન કાર્ડની વિગત,આઈટી એકટ મુજબની કેટેગરી તેમના ડીપી અથવા જો વાસ્ટ
લોનધારકો/જામીનદારોને આ		<mark>ઝનુસાર કાચદેસર ર્</mark> ીખ પહેલાં વ્યાજ અને	ોતે 30 દિવસની અન્ય ખર્ચ સાથે માં	<mark>વેચાણ નોટીર</mark> ગણાની રકમ જ		<ul> <li>સૌના પ્રયાસના મંત્ર</li> <li>સાથે નરેન્દ્રભાઈએ</li> <li>ગુજરાત અને દેશમાં સર્વાંગી વિકાસની કાર્ય</li> </ul>	ਮੁਠਾਹੀਤ ਮ	0217-180055613 મણીરામ કુરળા અને મહાવીર કુશ્વાહા	20-04-2021 0 ຫເຊັ 700314/-	01-09-2022 <del>ફ</del> લેટ ਵੇસੀਤ	ટ નં૧૦૦, ગ ડેન્સીની બાજુમાં, ર ટરી, ચોર્ચાસી, સુર	ોકુલદ્યામ રેસીડેન્સી સાચણ, બ્લોક નં૯૦ ત ગુજરાત ૩૯૫૦૦૫ સહી/- ાધિકૃત અધિકારી	, विनायङ /१/એ, सगर	શેર ધરાવતા હોય તો કંપની/ રજિસ્ટ્રારને લેંખિતમાં વિનંતીપત્ર શેરમાં પ્રથમ નામ ધરાવન સહી સાથેનો અને સેલ્ફ એટેસ્ટેડ નક્લો તા.સ્૧મી સપ્ટેમ્બર,૨૦૨૨ પહેલા મોકલવાના જેની વિસ્તૃત ભાઇકારી એજીએમ નોટીસમાં આપવામાં આવી છે. આથી નોટીસ આપવામાં આવે છે કે સભ્યોનું રજિસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બ ગુરૂવાર, ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી બુધવાર ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૨( બંને દિવસો સાથે ૨૦૨૧-૨૨ની એજીએમના હેતુ માટે બંધ રહેશે.
તારીખઃ ૦૫.૦૯.૨૦૨૨ - ર					ધેકારી - બરોડા ગુજરાત ગ્રામીણ બેં શન એન્ડ રીકવરી ડીપાર્ટમેન્ટ / મુંબઈ	<sup>ક</sup> સંસ્કૃતિ વિકસાવી છે.	* ભાષાંતરમાં ગુરી	અથવા વિસંગતતા હશે જાહેર ચેતવ			(એસ્પાચર હોમ	ફાઈનાન્સ કોર્પોરેશ	-	ું બે કોઈ સભ્ય(ચે) એ તેમના ઈમેલ એડ્રેસ નોંધાવ્યા ન હોય તો તેઓ નીચે મુબ સુચનાઓ મુજબ નોંધાવી શકશે. <b>ઇ-મેલ એડ્રેસ રજિસ્ટર કરાવવું/અપડેટ કરાવવાની રીત</b> : વાસ્તવિક શેર દ
વસુબેન અરવિંદકુમાર ધીવાળા પે તેમજ તેઓનો વેચાણ દસ્તાવેજ મં થી તારીખઃ ૨૪/૦૮/૨૦૨૨ ના અરવિંદકુમાર ધીવાળાપાસેથી વેચ	જાહેર નોટીસ વવાનું કે, નીચે જશાવેલ વિગત ર ાતાની સ્વતંત્ર માલીકી તથા ભોગવ કે. સુરતના સબ રજીસ્ટ્રાર સાહેબની . રોજ નોંઘાયેલ છે. જે મિલકત ાછાથી ખરીદવા માંગતા હોય મજકુ ાટકાયત, વાર્જ, બોજો કે લીયન હોય	અને વર્જ્ઞનવાળી મિલક ાટા હેઠળ ચાલી આવેલ ! કચેરી (અલથાણ)માં ર હર્ષા ગૌતમકુમાર જેઠલ રૂર મિલક્તમાં જો કોઈ	ા તેમ જણાવેલ છે. અનુક્રમ નં. ૬૨૮૯ વા નાઓ વસુબેન લાગ-ભાગ, હકક-	<sup>એડ્રેસ ૧૩૪</sup> , સિ <del>ક્</del> ચો વંચાતા દિ ઓફ સિ	ભઈ કીવીઝન ૧૩મો માળ, જોલી મેકર ચેમ્બર્સ નં.૨, નરિમા રીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિ રોક્ટ્યોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક ક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨	પાઇન્ટ, સુંલઇ ૪૦૦૦૨૧ થમો, ૨૦૦૨ ના નિચમ ૮ (୨)ની વ શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ મ	અને એન્ફોર્સમેન્ટ તટે વેચાણ નોટીસ.	60	સાવલીયા, વળગતા દર્જ્યાવેલ કે સાવલીયા, અમારી સા દેવા, વ્યવ વ્યકિત કે	ਵਨੇ. ਲੁਵਰਗਾਈ ਲ ਅਜੇ ਅਨੇਵ ਆਰਥ ਮੋਟਾਬਾਸੀ ਕਾਸੀ ਕਾਲਿ , ਕੇઓ ਅਸਾਦ ਰਵ ਸ਼ੋ ਵਨੇਗ ਜਬੀ. ਰੇਜੀ ਜ ਨਾਦੀ ਅਜੇ ਲੱਕਬ ਜਾ ਲੰਦਬਾਐ ਤੀਬੀਪਾਲ ਅ	ારકારી, અધંસરકાર મ/જનતાને જણાવી તેત અમારા પુત્ર નામે સા અમારા પરિવારત સાથે અમારા પરિવારત સાથે અમારા પરિવાર ગ થી, જેથી અમારા ગ ાતના નાણાકીથ વ્યવ	તથા રીટાબેન શંભુભા તે કચેરીઓ તથા લાગ એ છીએ કે, બાજુ અંકિતકુમાર શંભુભા તા કહ્યામાં નથી, તેર મારા પરિવર્ત કોઈ લેવ પજકુર પુત્ર સાથે કોઈપ લાશે કરવા કરાવવા નલ	તા માં થી મા પ ડી	માટે: સભ્યો કંપનીને ઇમેલ દ્વારાવિનેતી આ મેલ આઇડી પર મોકલી શકે છે : investo sartafibers.comઅથવા અમારા આરટીએ ને mt.helpdesk@linktime.co.in ઉપર મં શકે છે. <b>ડીમેટ શેર ધારકો માટે :</b> વે સભ્યો ડીમેટ શેર ધરાવતા હોય તેમણે રવિસ્ટિર કરાવ અપડેટ કરાવવા તેમના ઇમેલ એડ્રેસ તેમના ડીપોઝીટરી પાર્ટીસિપેન્ટસને મોકલવાના રહે ર૯મી એજીએમની નોટીસ સમયસર ઇમેલ એડ્રેસ નૉધાવનરાને જ મળશે. વતિ સરલા પરફોર્મન્સ ફાઇબર્સ લિમ ર
તો દિન-૭ માં લેખીત દસ્તાવેજી પુ જો મુદત વિત્યે કોઈના કોઈપણ જ આથી તમામે નોંધ લેવી અને આગ	રાવા સાથે અમારા નીચે જણાવેલા તતના વાંધાઓ આવશે તો તેવા વ ળની કાર્યવાહી કરવામાં આવશે જેન <u>-: <b>મિલકતની વિગત</b>:-</u>	એડવોકેટશ્રીની પાસે અ ાંધાઓ ધ્યાને લેવામાં = તી નોંધ લેશો.	ાવી નોંધાવી જવા. આવશે નહી. જેની	આવે છે ગીરો/ચા અધિકૃત	કે નીચે જણાવેલ સ્થાવર મિલ જંડ કરાયેલ છે જેનો ભૌતિક ક અધિકારીએ લઇ લીધેલ છે જે	ીનદારો અને જાહેર જનતાને ન કતો ફેડરલ બેંક લીમીટેડ ( સિક બજો ફેડરલ બેંક લીમીટેડ (સિક બેનો <b>બચાં છે, જે છે અને જે</b> રેંગ્ને <b>ક</b> રેંગ્ન અને જે છે અને જે	ર્ક્યોર્ડ લેશદાર) ને ક્યોર્ડ લેશદાર)ના મ <b>છેના ઘોરણે હ</b>	મીલકતમાં કોઈ હક	દેવા કે તે ત માંચી અમારા પુત્ર ક,હિત, હિસ્સો, વ	અંગે અમારી કોઈ ને બેદખલ કરેલ છે. ારસાઈ હકક, રાખ્યે	જવાબ્રદારી નથી ૨ તેનો અમારી કોઈપ શે નથી અને રહેશે	ਮਾਦਾ ਪਵਿਧਾਵਜੇ ਭੀਈ खेव ਜਗੇ ਵહੇਵੀ ਗਉਂ, ਲਾਮੀਵ 21 ਵਬਾਕਵ ਤੇ 'ਬੰ'ਸਮ ਸਾਰ ਗਉਂ ਲਾਗੇ ਰੇਗੀ ਵਾਡੇ ' ਬਤਿੰਗ ਰ <b>ਗ ਲੱਤਿਰਤ੍ਰ</b> ਮ।	55	સ્થળ : મુંબઈ (નેહા સોમા તા. ૩જી સપ્ટેમ્બર,૨૦૨૨ કંપની સેકેટરી અને કોમ્પ્લાયન્સ ઓપ્ ાટલાઇનપીએસ એન્ટરપ્રાઇસિઝ લિમિટેડ (અગાઉ સ્ટારલાઇન પ્રિસિયસ સ્ટોન લિમિટેડ તરીકે જાણિતી)
પૈકીથી નોંધાયેલ જમીન કે જેનો ટેં બિનખેતીની જમીનમાં આવેલ <b>''</b> ઇન્ડસ્ટ્રીયલ શેડો પૈકી <b>પ્લોટ નં. ૧૪</b>	<b>રુત સીટીના, મોજે</b> શહેર સુરતના વ I. પી. સ્કીમ નં. ૬ (મજુરા-ખટોદર <b>સદાનંદ ઇન્ડસ્ટ્રીયલ કો. ઓ. સર્વિર</b> 1 ની મિલક્ત કે જેનું ક્ષેત્રફળ ૧૫ ફુટ નોંધ નં. ૪૧૦ પૈકીથી નોંધાયેલ છે,	શ), ફાયનલ પ્લોટ નં. ર <b>સ સોસાયટી લી.''</b> વ્રારા ઽબાય ૬૦ ફુટ યાને <b>૮૩</b>	૩૫૬ થી નોંધાયેલ ા પાડવામાં આવેલ 3. <b>૬૧ ચો.મી.</b> છે જે	<mark>શ્રીમતી</mark> હાઇટ સ જણાવેલ છસો ઓ	સુચિત્રા પ્રમોદ સિંહાં બંને નામે, ભીમરાડ રોડ, અલથન તારીખ મુજબ રૂા.૧૪,૦૦,૦ ોગણત્રીસ અને પચાસ પૈસા પુ	સેંહા પ્રમોદ કુમાર એન્ડ કાું. ર ૨હેણાંક ડી-૧૦૪, અનુપમ ર ા સુરત, ગુજરાત - ૩૯૫૦૦૬ ૨૯.૫૦/- (રૂપિચા ચૌદ લાખ (રા)ની ફેડરલ બેંકની બાકી રકમ	<b>સૃષ્ટિ, શાલીગ્રામ</b> ત્ર. પાસેથી ઉપર <b>સીત્થોતેર હજાર</b> નની વસુલાત માટે	અમારી માલ-મીલક સંસ્થાઓ, સરકારી, લિન્ શંભુભા	તની કોઈ જવાબદ અર્ધસરકારી કચેરી ઈ ૨વજીભાઈ સ	ारी रहेशे नही, ते  ओओ तथा खागता    ायसीखा	તેની ૧૧૯૨ જનતા વળગતાઓએ ગંભ લા	અમારા પરિવારજને ક છે તથા બેંક, મંડળ્ ંગે નોંધ લેવી. પાર મારફત પ્રાર. ગાંગાણી		(અગાઉ સ્ટારલાઇન પ્રાપ્યયસ સ્ટાન લામટડ તરાક પાલતા) (CIN:L36910GJ2011PLC065141) રજીસ્ટર્ડ ઓફિસ: દુકાન નં એફ/૧, પહેલે માળે, અઠવા આર્ક શોપિંગ સેન્ટર, ચતિમ ખાના સામે, અઠવા ગેટ, સુરત-૩૯૫૦૦૧. ગુજરાત. ફોન નં. : ૦૨૬૧-૨૬૦૦૩૪૩, મો.: +૯૧-७૦૪૩૯૯૯૦૩૦
વત્તા બીજો માળ વત્તા ત્રીજો માળ સોસાયટી તરફે ફાળવવામાં આવેલ વળગતા અંદરના તથા બહારના ત <b>ઓફીસ : ૧/૬૨૪ ગ્રાઉન્ડ ફ્લો</b>	ા મળીને કુલ્લે પ૨૧.૩૦ ચો.મી. બીં ા રૂા. ૫૦/- ના એક એવા શેર નંગ - મામ હકકો સહિતની કુલ્લે દરોબસ્ત <b>ર, ખારવા શેરી,</b>	lલ્ટ અપ બાંધકામ ચાલીં - પ સહિતની મિલકત તૈ	આવેલ છે. તે તથા તે તથા તેને લાગતા	હજાર પુ	રા) રહેશે અને અર્નેસ્ટ મની િ સહજાર પાંચસો પુરા) રહેશે.	૨,૮૫,૦૦૦.૦૦ (રૂપિયા બાર ઙેપોઝીટ રૂા.૧,૨૮,૫૦૦.૦૦ ( મેલ્કતનું વર્ણન		किंक ऑफ़ बड़ी Bank of Baro	મુભાઈ સાવલીયા તા ક્લારગામ શાખ તાલાશ્રમની સ ફોન : 0261-2	મા, પ્લોટ નં.A-16, ામે, ક્રતારગામ રોડ 2480088, E-mai	મીનેબિજાર , પટેલ ઈન્ડસ્ટ્રીચ ડ, સુરત-395004 il : katarg@ba	વરાણ શેક, સુરત લ કો-ઓપ.સોસાચ nkofbaroda.com	<b>ટી,</b> આથી	<b>ઇ-મેઇલ:info@starlineps.com</b> wesite:www.starlineps.com जीजी ૧૧મી સામાન્ય વાર્ષિક સભા, હિસાબી ચોપડા બંધ કર <u>અને ઇ-વોટીંગની માહિતી માટેની નોટીસ</u> ભણાવવાનું કે સ્ટારલાઇનપીએસ એન્ટરપ્રાઇસિઝ લિમિટેડ (અગાઉ સ્ટારલ
સારંગ જીમ પાસે, બહુમાળી બિ તિરૂપતી પ્લાઝા રોડ, નાનપુરા, મો. ૯૦૧૬૨૮૮૦૧૦	ાહીંગની પાછળ, સુરત -૩૯૫૦૦૧. ામ શાખા, પ્લોટ નં.ઠ-ા6, પરં	(એડવે	(કર્ટ)	અવિભા લગતી ત સાઈડન	જીત વણવહેંચાયેલો હિસ્સો સા ામામ ઉપાધિઓ સાથે, જે જમી ા પ્લોટ નં. ૩.૪.૭.૮.૧૧ અન્	ડીંગ નં. સીંજેની માપણી ૪ થે નોવા કોમ્પેલક્ષ તરીકે ઓળખ ન પર સ્થિત છે, તેના રેવન્યુ સર્વ ને ૧૨, સીટ્રી સર્વે નં. ૪૨૪૯/૨	ાાતી સોસાયટીને ર્ય નં. ૯ પૈકી ઉતર ૨. ફાઈનલ પ્લોટ	લેણદારને નોટીસ (૧ પ્રતિ, શ્રી બાબુભાઈ કાનજીભ	ે સરફેસી એક્ટ, 200 નાઈ વડોદરીયા, શ્રીમર્ત હારા રો-હાઉસ-1, દ	02ના કલમ 13ના પેટ ી મમતાબેન બાબુભાઇ રરબાર ફળિવ્રું, મોટા	ટા વિભાગ (2) હેઠળ ઇ વડોદરીચા, શ્રી આ	1) तारीખ : 01-09-20 કાશકુમાર બાબુભાઈ પટેલ	22 ਪੀਸੀ ਜਾ ਤੀ <i>ਾ</i> ਝ આવી	ચસ સ્ટોન લિંમિટેડ તરીકે ભાશીતી)ના સભ્યોની ૧૧મી સામાન્થ વાર્ષિક સભા (એજીચં પ્રાર ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે (ભારતીચ સમય મુજબ) વિડ પ્રન્ટન્સીંગ દ્વારા (વીસી), અધર ઓડિયો વિઝ્ચુઅલ મીન્સ (ઓએવીએમ) દ્વારા યોજવ ! છે. જેમાં નોટીસમાં જણાવ્યા મુજબ ૧૧મી સામાન્થ વાર્ષિક સભામાં એક્સપ્લેને
Bank of Baroda । Bank of Baroda । Bank of Baroda इोन :	ામની સામે, ક્લારગામ રોડ, સ્ 0261-2480088, E-mail : મ એક્ટ, 2002ના કલમ 13ના પેટા વિ	मुरत-395004. katarg@bankoft	oaroda.com	જેની ચતુ રોડ, અન્	ર્ડુસીમાઃ પૂર્વ ઃ રેવન્યુ સર્વે નં ૧ ને દક્ષિણ ઃ રેવન્યુ સર્વે નં. ૯ પૈર્ક	સરા, તાલુકો ઉધના અને સુરત l ૦ મોજે પાંદેસરા, પશ્ચિમ : પ્રાર્ધ l સીટી સર્વે નં. ૪૨૫૯ યમો માટે ફેડરલ બેંક લીમીટે	ઈવેટ રોડ, ઉત્તર :	વિષય ઃ સિક્યુરીટાદ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ	ઝિશન અને રીકન્સ્ છે એક્ટ , 2002ના સ શ્રી બાબુભાઈ કાન્સ	ટ્રક્શન ઓફ ફાચન સેક્શન 13(2) હેઠ જીભાઈ વડોદરીચા, 4	ળના કાચદા હેઠેળ શ્રીમતી મમતાબેન	એન્ડ એન્ફોર્સમેન્ટ એ . (ઢવે પછી અહીં નિર બાબુભાઈ વડોદરીચા,	ો) <del>ફ</del> સ્ટેટમે યમ થતા	મેન્ટ, ડાચેસ્કટર્સ રિપોર્ટ,ઓડીટર રિપોર્ટ અને કંપનીના ૩૧મી માર્ચ, ૨૦૨૨ના રોજ વર્ષ માટેના ઓડીટેડ ફાઇનાન્શ્યલ સ્ટેટમેન્ટસ સંબંધી કામકાજ હાથ ધરવામાં આવ કિ વર્ષ ૨૦૨૧-૨૨ના વાર્ષિક અદેવાલો ૩જી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ નોટીસ સાથે ત

પ્રતિ, શ્રી જયંતિભાઈ વલ્લભભાઈ ડોબરીચા

પ્રતિ,	વચાડા ા વગતવાર સરતા અને નવના માટે રેડરરા બેઠ લાનાટડા વગસાઇટ	212/2).22					સભ્યો કે જેમના નામ રદમી ઓગસ્ટ	, ૨૦૨૨ સુધી કંપનીના ૨જીસ્ટર્ડમાં નોંધાચેલા હોચ તેમને
શ્રી જયંતિભાઈ વલ્લભભાઈ ડોબરીયા	એટલે કે https://www.federalbank.co.in/web/guest/tender-notices.માં આપેલ	સર/મેડમ, સંદર્ભ :અમારી કતારગ	ער גרור ערייט וניי	م مرد ما در او	atu			નોંધ લેશો કે, કંપનીના સભ્યોને એમસીએ અને સેબીના
ફ્લેટ નં .307, ચમુના એપાર્ટમેન્ટ , ચમુનાકુંજ સોસાચટી , કરંજ , સુરત .	લિંક જોવા વિનંતી છે.	સદલ્ભ : અમારા કતાર	ામશાબા,સુરતસા	ાય ક્રાડેટ સુષ્	વવા. તંદર્ભે, જેમાં વિવિધ ક્રેડિટ સુવિધાઓ	الباريدية فالمحاص		સાપેક્ષ નક્લો મોકલવામાં નહીં આવે. આ દસ્તાવેજો
શ્રી બાબુભાઈ કાનજીભાઈ વડોદરીયા, શ્રીમતી મમતાબેન બાબુભાઈ વડોદરીયા, શ્રી આકાશકમાર બાબુભાઈ પટેલ :	ફેડરલ બેંક લીમીટેડ વતી	મંજરી આપવામાં આવી	B/ADV, (tt.21−03 മിഗ്വരിക്ഷ്യരിമ	-2014-itte	તેના માટે સુરક્ષા પ્રદાન કર્યા પછી કે	િંગ્લ ન જૂરા ના રાસ્તાના દિર ગ્રવિધાઓનો લાભ		
પ્લોટ નં. 195, આનંદધારા રો-હાઉસ-1, દરબાર ફળિયું, મોટા વરાછા, સુરત.	અધિકૃત અધિકારી, લોન કલેક્શન અને રીકવરી વિભાગ	લીધો છે અને તેનો ઉપયો	ગ કરવાનં શરૂ કર્યં છે	જેમ કે પછી	ીથી જણાવ્યું છે. વિવિધ લોન/ક્રિડિટ	કેસિલિટી એકાઉન્ટસમાં		s.com અને નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લિમિટેડ
<mark>અને :-</mark> A-1004, રાજહંસ ટાવર , મોટા વરાછા , સુરત	તા. ૦૩-૦૮-૨૦૨૨ નું મુંબઇ ડિવિઝન	હાલની બાકી રહેલી રકમ	અને આવી જવાબદાર	, ગરડ હા શમાટે બનાવ	ાવામાં આવેલ સુરક્ષા હિત નીચે મુજ	પ્રાથ:	( એનએસડીએલ )ની http://www.e	evoting.nsdl.com પ૨ ઉપલબ્ધ છે.
ao/Aku	સ્થળ : સુરત (સરફૈસી એક્ટ હેઠળ અધિકૃત અધિકારી)		1		ਅ਼ੀ ਵਿਤਸ di. 01-09-2022		વધમાં જણાવવામાં આવે છે કે, કંપ	નીઝ એક્ટ ૨૦૧૩ ખંડ ૧૦૮ . કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ
સંદર્ભ : શ્રી બાબુભાઈ કાનજીભાઈ વડોદરીયા, શ્રીમતી મમતાબેન બાબુભાઈ વડોદરીયા અને શ્રી આકાશકુમાર		ુઆપેલી	લીમીટ	વ્યાજનો	સુધી ( તા.01-09-2022 સુધી	2 ારાક્લાપ્ટડાઝળા ) ટંદા તાર્પત ગાળે	अंऽमीनीस्टेशन् ) उत्स २०१४ ना उ	લ ૨૦ સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેસન્સ એન્ડ ડ્સિક્લોઝર
બાબુભાઈ પટેલ ટર્મ લોન એકાઉન્ટ નં. 42700600001013 ને આપવામાં આવેલી હાઉસિંગ લોન (ટર્મ લોન)	લોન કલેકશન એન્ડ રીકવરી ડીપાર્ટમેન્ટ / મુંબર્શ ડીવીઝન	સુવિધાનો પ્રકાર	( રૂપિચામાં )	53	વ્યાજ સહિત )	સીક્યોરીટી કરાર		ના ૨ેગ્યૂલેશન ૪૪ને ધ્યાનમાં લેતા કંપની ત૨ફથી
સુવિંધાઓ માટે તમારી ગેરટી બાબતે.	El éssee d'és el. LCRD/ idef státhad	ટર્મ લોન			31 28 36 969 80 + 6131 -			ાટે ઇલેટોનીક વોટીંગ ફેસીલીટી (''રીમોટ ઇ-વોટીંગ'')
1) તમે જાણો છો તે પ્રમાણે તમોએ તા.25-03-2014ના રોજ ગેરન્ટી આપેલ છે કે તમામ જવાબદારીઓ અને કરજો		(હાઉસીંગ લોન)	<b>₹1.33,00,000</b> /-	9.20%	રૂા.28,36,969.80 + લાગુ ન થયેલ વ્યાજ અને અન્ય ખર્ચાઓ	નીચે જણાવ્યા		
કરવાની ગેરન્ટી આપેલ અથવા ત્યાર પછી કોઈપણ સમયે શ્રી બાબુભાઈ કાનજીભાઈ વડોદરીયા, શ્રીમતી	એડ્રેસઃ ૧૩૪, ૧૩મો માળ, જોલી મેકર ચેમ્બર્સ નં.૨, નરિમાન પોઈન્ટ, મુંબર્ઇ ૪૦૦૦૨૧	કલ	21.22.22.22.22.2		રૂા.28,36,969.80 + લાગુ ન		અનઅસડાઅલ તરફથા પુરા પાડવ	ામાં આવશે. અને નોટીસમા જણાવવામાં આવેલા તમામ
મમતાબેન બાબુભાઈ વડોદરીયા અને શ્રી આકાશકુમાર બાબુભાઈ પટેલ ને રૂા.28,36,969.80/- (રૂપિયા અકાવીસ લાખ છત્રીસ્ હજાર નવ સો ઓગણોસીત્તેર રૂપિયા અને એંસી પેસા પૂરા)+લાગુ ન	સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિચમો, ૨૦૦૨ ના નિચમ ૮ (૬)ની જોગવાઇઓ સાથે	395	રા.33,00,000/-	-	થયેલ વ્યાજ અને અન્ય ખર્ચાએ	à l		ટ ઇ-વોટીંગની માહિતી નીચે મુજબ છેઃ
( રૂપિયા અટાવાસ લાખ છેત્રાસ હજાર નવ સા આગણાસાત્તર રૂપિયા અને અસા પસા પૂરા) + લાગુ ન થયેલ વ્યાજ તથા અન્ય ખર્ચાઓ સહીત અને તેની ઉપરનું વ્યાજ જે આ ગેરન્ટી દસ્તાવેજમાં ઉલ્લેખિત છે.		મોર્ટગેજ કરેલ મિલકતો	<b>ની વિગત</b> : તમામ ભ	ાંગ અને હિર	સ્સા સહિત પ્લોટ નં.195, અંદાજી	પ્ર માપ આશરે 89.74		સપ્ટેમ્બર, ૨૦૨૨ (સવારે ૯.૦૦ વાગ્યે) શરૂ થશે અને
યવેલ વ્યાંજ તેથાં અન્ય બંચાંબા સહાત અને તેના ઉપરંગુ ખાંજ જ આ ગરેન્ટા ટસ્તાપેજના ઉલ્લાખત છે. બાંહેધરીની જવાબદારી સુરક્ષિત કરવા માટે, તમે અમને નીચેની સિક્યોરિટીઝ પણ પુરી પાડી છે.	વંચાતા સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાચનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ	ચો.મી., રસ્તા અને સીં	<u></u> ઓપીમાં અવિભાજીત	ા પ્રમાશસર (	હિસ્સા સાથે માપ 31.50 ચો.મી.	, આનંદધારા રો-હાઉસ	રવિવાર ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨	ર (સાંજે ૫.૦૦ વાગ્યે) પુરુ થશે. ત્યાર બાદ ઇ-વોટીંગ
2) તમામ ભાગ અને હિસ્સા સહિત પ્લોટ નં.195, અંદાજીત માપ આશરે 89.74 ચો.મી., રસ્તા અને સીઓપીમાં	ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ.				0, 481+482, બ્લોક નં. 492+		મોડ્યૂલ પર મતદાન થઇ શકશે	
અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ 31.50 ચો.મી આનંદધારા રો-હાઉસ તેને લગતી તમામ	આથી ખાસ કરીને દેવાદારો અને જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં				મોટા વ્રાછા), કાઈનલ પ્લોટ્નં. લ			સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ જે સભ્યો કંપનીની પેડઅપ શેર
અનુરૂપતાઓ સાથે, રેવન્યુ સર્વે નં. 480, 481+482, બ્લોક નં. 492+493, એકત્રીકરણ પછી નવો બ્લોક નં.		વરાછા, સબ ડિસ્ટ્રી. સુ	રત, જી. સુરત ખાત	સ્થિત. જેન	ી ચતુર્સિમા : પૂર્વ : લાગુ પ્લોટ -	ા.184, પશ્ચિમ : લાગુ	કેપીટલ ઘરાવે છે. તેના પ્રમાણે મ	
492 પૈકી ભાગ-2, ટી.પી. સ્ક્રીમ નં. 25 (મોટા વરાછા), ફાઈનલ પ્લોટ નં. 67 અને 68, ગામ મોટા વરાછા,	આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો ફેડરલ બેંક લીમીટેડ (સિક્યોંર્ડ લેણદાર) ને	સોસાયટીનો રસ્તો, ઉત્તર	-		*			
સબ ડિસ્ટ્રી. સુરત, જી. સુરત ખાતે સ્થિત. જે મિલકત શ્રી બાબુભાઈ કાનજીભાઈ વડોદરીયાના નામે સ્થિત છે.	ગીરો/ચાર્જડ કરાયેલ છે જેનો ભૌતિક કબજો ફેડરલ બેંક લીમીટેડ (સિક્યોર્ડ લેણદાર)ના			22 ના રોજ પ	પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે	ટ ઉપરની લોન/બાકીના		૨૦૨૨ના રોજ સભ્ય બને અને ઇક્વીટી શેર ધરાવતી હોય
જેની ચતુર્સિમાં : પૂર્વ : લાંગુ પ્લોટ નં.184, પશ્ચિમ : લાગુ સોસાયટીનો રસ્તો, ઉત્તર : લાગુ પ્લોટ નં.194,	અધિકૃત અધિકારીએ લઇ લીધેલ છે જેનો <b>જ્યાં છે, જે છે અને જેમ છેના ઘોરણે ૦</b> ૦	વ્યાજની ચુકવણીમાં		(		Concern a state of a concern		ની છેલ્લી તારીખ સુધીમાં નોટીસ અને શેર ધરાવતા હોય
દક્ષિણ :લાગુ પ્લોટ નં. 196. 3) અમે તમને સુચિત કરીએ છીએ કે કરજદાર કસુરવાર સાબિત થયા છે તેથી તેમના એકાઉન્ટને નોન પર્ફીમિંગ	ઓકટોબર, ૨૦૨૨ ના રોજ (૧)શ્રી વિજય હંસરાજભાઈ વેકરીયા અને સહ કરજદાર	3) તમારા દ્વારા બાકા રક	મના ચુકવણા કરવામાં ગે તા ૨૦-૦૦-૨૦૨૨	ા કસુર થઇ હા ના ગેજ નોન	ોવાથી તમારા લોન એકાઉન્ટ ભારત 1 પર્ફોર્મીંગ એસેટસ તરીકે જાહેર કર	ાય રાઝવ બકના ાનયમાં તામાં આવેલ છે. આમાગી		ટે લોગીંન આઇડી અને પાસવર્ડની સાથે evoting@nsdl.
) અને લેવના સુવિલ કરાબ છોબ કે કે કે કે કે કે કુ સુવલ સાળતા પંચા છે લેવા લેવના અંકા કે કે ગળવા વગાવે છે. એસેટ તરીકે વર્ગીકુત કરવામાં આવ્યું છે. સિક્યોરીટાઈઝેશન અને રિકનસ્ટ્રક્શન ઓફ ફાયનાન્સીયલ એસેટ્સ	(૨) શ્રીમતી વેકરીચા પૂજાબેન વિજચભાઈ (૩) શ્રી સંજય હંસરાજભાઈ વેકરીચા				ા વગાવાળ અસટ્સ લારાક જાહર કર પરવ્યાજસહિતની બાકી રકમની ચુક		co.in अने info@starlineps.co	m પર વિનંતી મોકલવાની રહેશે.
અને એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, 2002ના સેક્શન 13(2) હેઠળ તા.01-09-2022ની	અને (૪) શ્રીમતી મધુબેન સંજચભાઈ વેકરીયાં બેંને રેહણાંક બી-૨૭૨, શ્યામ નગર				રા મેળવેલ ક્રેડિટ સુવિધાઓના સંદ		(૪) સભ્ય તે કે તેણી દ્વારા એક વખત	મતદાન થચા પછી તે બીજી વખત મતદાન નહીં કરી શકે.
નોટીસ અમારા દ્વારા કરજદારને મોકલી આપવામાં આવી હતી જે અહીં સામેલ છે. કરજદાર કસુરવાર સાબિત	<b>સોસાચટી, નવાગામ, કામરેજ, સુરત, ગુજરાત - ૩૯૫૦૦૬.</b> પાસેથી ઉપર જણાવેલ				બેકાઉન્ટના નોન પર્ફોર્મીંગ એસેટ્સ		(੫) ਦੀ ਸੀਟ ਬ-ਧੀਟੀਂ ગથੀ ਸਰદਾਰ ਤ	2નાર સભ્ય એજીએમમાં હાજરી આપી શક્શે. પરંતુ તે
થયા છે માટે બાંહેધરીની દષ્ટીએ બાકી ચઢેલા લેણાં/લોન સુવિધાઓ ઉપરોક્ત ફકરા 1માં જણાવેલ બેંકની બાકી		આવ્યા હોવાથી અને	ો અહીં તમને સિક્યુ	ારીટાઈઝેશન	. એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈન	ાન્સીયલ એસેટ્સ એન્ડ	ਤਦੀથੀ ਮਰદਾਰ ਤਦੀ શકશે ਰહੀ	
રક્રમ્ રૂા.28,36,969.80/- (રૂપિયા અછાવીસ લાખ છૂંત્રીસ હજાર નવ સો ઓગણોસીત્તેર રૂપિયા અને	તારીખ મુજબ રૂા.૫૭,૮૯,૩૨૪.૨૯/- (રૂપિયા અઠાવન લાખ નેવ્યાસી હજાર ત્રણસો	એન્ફોર્સમેન્ટ ઓફ રિ	ાક્યુરીટી ઈન્ટરેસ્ટ એ	ક્ટ 2002ની	ી કલમ 13ની પૈટા કલૂમ (2) હેઠળૂ	ા તમને નોટીસ આપીને		કાર્ચરત શ્રી મનિષ આર. પટેલ (સીઓપી ૯૩૬૦)ની
એંસી પૈસા પૂરા) + લાગુ ન થયેલ વ્યાજ તથા અન્ય ખર્ચાઓ આ નોટીસ પ્રસિદ્ધ થયા તારીખથી 60 દિવસની	ચોવીસ અને ઓગણત્રીસ પૈસા પુરા)ની ફેડરલ બેંકની બાકી રકમની વસુલાત માટે	ઉપરોક્ત ફકરા 1માં ઉ	જણાવેલ બેકની બાકી	રકમ <b>રૂા.2</b> 8	,36,969.80/-(રૂપિયા અટ્ટાવી	સલાખછત્રીસહજાર		ક બને એ માટે કરવામાં આવી છે.
અંદર અમારી બાંકીની રર્કેમ ચુકવી દેવાનું જણાવવામાં આવે છે. કૃપા કરીને નોંધ લેશો કે કરજદારને આપવામાં આવેલી તા.01-09-2022ની નોટીસના પેરા-1 પ્રમાણે નિર્ધારીત કરવામાં આવેલા દરો પ્રમાણે વ્યાજ ચાલુ	વેચવામાં આવશે. રીઝર્વ કિંમત રૂા.૪૨,૩૦,૦૦૦.૦૦ (રૂપિયા બેતાલીસ લાખ ત્રીસ	નવ સા આગણાસા	તર રાપયા અન અસ્	ા પસા પૂરા	) + લાગુ ન થયેલે વ્યાજ + અન્ય 60 દિવસની અંદર ચુકવીને તમને ન	ા ખચાઆ અને લાગુ ન		
આપલા તા.01-09-2022ના નાટાસના પરા-1 પ્રનાકા ાનપારાત કરપાના આપલા દરા પ્રનાકા વ્યાજ ચાલુ ગઢેશે	હજાર પુરા) રહેશે અને અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂા.૪,૨૩,૦૦૦.૦૦ (રૂપિયા ચાર લાખ	યવલ વ્યાજ અને અને અદા કરવાનં જાગાવ	પ પંચાઓ આ માટા 11માં આવે છે. અમે ત	લ ગાવ્લાથા છે. મને વધમાં ન	30 ાદવસના અદર ચુકવાન તનન ન કોટીસ આપી જણાવીએ છીએ કે ચુક	તાલાકાલ જવાબદારાઓ તાંગી તાંગીખ સંધી વ્યાજ		નણ પુછપરછ હોય તો તેમણે ફીક્વન્ટલી આરકડ ક્વેશ્વન
પડરા. 4) અમે તમને આગળ જણાવવા માંગીએ છીએ કે કરજદારે લીધેલી લોન અને એડવાન્સ રકમ ચકવવા માટે તેમના	ત્રેવીસ હજાર પુરા) રહેશે.				ાટાસ ગામ કડાવાગ છાગ કપુક 1ી કલમ 13ની પેટા કલમ 4 હેઠળન			ો અને ઇ-વોટીંગનો ઉપયોગ કરનારાઓ માટે મેન્થુઅલ
ંદ્વારા અમને પુરી પાડવામાં આવેલી સુરક્ષાના સંદર્ભમાં 60 દિવસની આ નોટીસને સિક્યોરીટાઈઝેશન એન્ડ		ઉપયોગ કરવાની અમ					મતદાન પણ ડાઉનલોડીંગ સેક્શન	http://www.evoting.nsdl.com/ સંપર્ક સાધી શર્ક છે
રિકનસ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ 2002ની કલમ	સ્થાવર મિલ્કતનું વર્ણન				નહીં આવે તો ત્યાં સુધી દરેક ક્રેડિટ	સુવિધા માટે ફકરા-1માં	અથવા શ્રી કેતન પટેલ, અધિકૃત	ખધિકારી, એનએસડીએલ, ચોથે માળે, 'એ'વીંગ, ટ્રેડ
(13)ની પેટા કલમ (2) પ્રમાણે નોટીસ ગણવામાં આવશે . તમને નોટીસ પાઠવીએ છીએ કે જો ઉપરોક્ત જણાવ્યા	પ્લોટ નં. ૨૭૨, જેની માપણી ૭૪.૩૪.૯૪ ચો. મી., જેની બાજુમાં માર્જીન એરીયા	્ જણાવ્યા પ્રમાણે દરે વ	યાજ ચઢવાનું ચાલુ રહે	હેશે			વર્લ્ડ, કમલા મિલ્સ કંપાઉન્ડ, લોંઅર	પટેલ મુંબઇ-૪૦૦૦૧૩, ઇ-મેઇલઃ ketankumarp@nsdl.
પ્રમાશેની રકમ તથા ચુકવણી તારીખ સુધી વ્યાજ સહિતની રકમ નહીં ચુકવવામાં આવે તો આ ધારાની કલમ	માપણી ૪૯.૮૨.૨૮ ચો.મી., કુલ માપણી ૧૨૪.૧૭.૨૨ ચો.મી., શ્યામ નગર				કોરીએ છીએ. જેની પરીભાષાઓ			૨૦૦ અને ટોલ ફ્રી નં. : ૧૮૦૦-૨૨૨-૯૯૦.નો પણ સંપર્ક
13ની પેટા કલમ (4) હેઠળ તમામ કે કોઈ અધિકાર ભોગવવાની અમને સ્વતંત્રતા રહેશે.	નાવેલા ૪૯.૮૨.૨૮ ચા.ના., કુલ નાવેલા ૧૨૪.૧૭.૨૨ ચા.ના., રવાન ૧૦૨ સોસાયટી તરીકે ઓળખાતી હાઉસિંગ સોસાયટીને લગતી તમામ ઉપાધિઓ સાથે, જે				ાંતરણ કરવાનો તમારા પર પ્રતિ સંસ્વી તેમાં ઉગ્લેખ નાંધમાં રોતં		કરી શકે છે.	
5) અમે તમારું ધ્યાન આ ધારાની કલમ 13ની પેટા કલમ (13) તરક દોરવા માંગીએ છીએ જે ધારાની પરિભાષામાં તમે અમારી લેખિત મંજરી વગર નોટીસમાં પેરા 1માં દર્શાવેલ સંપત્તિ વેચાણ/લીઝ કે કોઈ (સામાન્ય વ્યવસાય		(સામાન્ય વ્યવસાય) ધારાની દલમ 12(1	સવાય). જના માટ	અમારા પૂવ છેની જોગવા	મંજૂરી લેવાની રહેશે. વધુમાં એવું ાઈઓનું પાલન ન કરવું એ આ ધ	, જણાવાએ છાએ કે આ		મેક્ટ, ૨૦૧૩ના ખંડ ૯૧ની સાથે લાગુ પડતા રૂલ્સ અને
સિવાય) રીતે હસ્તાંતરીત કરી શકશે નહીં. અમે એ પણ જણાવીએ છીએ કે આ ધારાની કલમ 13(13) હેઠળની	જમીન પર સ્થિત છે, તેના રેવન્યુ બ્લોક નં. ૮૬ (જૂના સર્વે નં. ૭૯,૮૦,૮૧, ૮૨)મોજે	દંડનીય અપરાધ છે.	5/~ii 85ii~ii ×·ii	\$1.11 01-141	ાઇઓનું સંદાગ ન કરવું એ આ વ	1141-11 541-1 27 8091	પંધુના વેશાવવાંગું કે કવળાઝ સ	ગેક્ટ, રેઇવેડેળા બેડ દેવેળા સાથે લોગુ વડેલા રહેલ અને
ઉપરોક્ત જોગવાઈઓનું પાલન ન થાય તો તે આ ધારાની કલમ 29 હેઠળ દંડનીય અપરાધ છે.	નવાગામ, તાલુકા કામરેજ અને સુરત જિલ્લા, ગુજરાત. જેની ચર્તુસીમાઃ પૂર્વ :		ો છીએ તમારં ધ્યાન <i>ક</i>	કલમ 13ની પં	પેટા કલમ 8 તરફી દોરીએ છીએ જે	ડેમાં સરક્ષિત મિલકત જે	સબા (ાલસ્ટાંગ આબલાગંશન અન્ડ	ડિસ્ક્લોઝર રિક્વાચરમેન્ટસ) ના રેગ્યુલેશન ૨૦૧૫ ના
6) અમે આગળ તમને જણાવીને તમારું ધ્યાન એક્ટની કલમ 13ની પેટા કલમ (8) તરફ દોરીએ છીએ કે તમે	સોસાયટી રોડ, પશ્ચિમ ઃ પ્લોટ નં. એ/૨૫૨, ઉત્તર ઃ પ્લોટ નં. ૨૭૧, અને દક્ષિંણ ઃ	ટાંચમાં લીધેલી છે	તમામ બાકી રકમ,	તમામ ખર્ચા	ોઓ સહિત બેંકની બાકી છે તે	કોઈપણ સમયે અથવા		ર બુક ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ થી ૨૬મીં સપ્ટેમ્બર,૨૦૨૨
સુરક્ષિત મિલકત પાછી મેળવી શકેશો અગર તમે તમામ ખર્ચાઓ સહિતની બાકી રકમ બેંકને જાહેર	માર્જીન જગ્યા				ાજી/ક્વોટેશન મંગાવીને/ટેન્ડ્ર મં		( બંને સહીત ) બંધ ૨હેશે.	
હરાજી/ક્વોટેશના આમંત્રણ/ટેન્ડર/ખાનગી સોદાની જાહેર નોટીસની પ્રસિદ્ધની તારીખ પૂર્વે સંપૂર્ણ ચૂકતે કરશો	વેચાણની વિગતવાર શરતો અને નિયમો માટે ફેડરલ બેંક લીમીટેડની વેબસાઇટ				કશે. એ વાતની નોંધ લેશો કે ઉપ	ર મુજબ નોટિસ જાહેર	1	and the General server
તો. કૃપા કરીને નોંધ લેશો કે, ઉપર મુજબની જાહેર નોટીસ પ્રસિદ્ધિ થયા બાદ તમારી સુંરક્ષિત મિલેકત પાછી મેળવવાનો કોઈઅધિકાર રહેશે નહીં.	એટલે કે https://www.federalbank.co.in/web/guest/tender-notices માં આપેલ ફેડરલ બેક લીમીટેડ વતી				કોઈઅધિકાર રહેશે નહીં.		1	બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સના હુકમથી
મળવવાના કાઈ આપકાર રહેશ નહા. 7) કૃપા કરીને નોંધ લેવી કે ડિમાન્ડ નોટીસ પૂર્વાગ્રહ વિનાની છે. તેનાથી કોઈ માફી કે ઉપાયની વાત નથી બનતી અને		8/ કૃપા કરાન નાધ લ	શા ક આ નાટસિ ક દેલાયના માંટલાળ	ાઇપણ પ્રકાર નગીરે ગાગવ	રના પુર્વગ્રહ વગર આપવામાં ચ વામાં આવશે તેથી આ અંગે વધુ મ	માવલ છ અન અમારા in દરીબ જ્યાં મધી પરે	1	વતી સ્ટારલાઇનપીએસ એન્ટરપ્રાઇઝ લિમિટેડ
/) કૃપા કરાન નાવ લવા કા ડાનાન્ડ નાટાસ પુપા પ્રહાવનાના છે. તેનાવા કાંઇ નાણ કે ઉપાયના વાત નવા બનતા અન તેથી આ અંગે અમે વધુ માંગ કરી શકીશું જ્યાં સુધી પુરેપુરી રકમ ચુકવાઈની ન જાય.	આધિકૃત આધિકારી, લોન કલેક્શન અને રીકવરી વિભાગ	અનયાાદત આવકાર પુરી રકમ ચુકવાઈ ન		ા લારલક ગાંધીવ	નાના આવરા લવા આ અગે વધુ મ	ાગ કરાશું જેવા સુવા પુર	1	સ્વાતિ સોમાની
ાય ગાળવા વાય ગાળવા તે છે. આ પુરાય છે વિદ્યાર્થ છે તે વિદ્યાર્થ છે. આ પાનો વિદ્યાર,	તા. ૨૯-૦૮-૨૦૨૨ મુંબઇ ડિવિઝન	3.0.5 1.3.001				આપનો વિશ્વાસ.	સ્થળઃ સુરત	કંપની સેક્રેટરી અને કમ્પ્લાઈન્સ ઓફીસર
સ્થળ : સરત   તા. 01-09-2022 મખ્ય પ્રબંધક. અધિકારી.	સ્થળ : સુરત (સરફૈસી એક્ટ હેઠળ અધિકૃત અધિકારી)	સ્થળ : સરત   તા.	01-09-2022		મખ્ય પ્રબંધક, ર		તારખ: 03-૦૯-૨૦૨૨	એસીએસ નં.: ૬૮૪७૨

સભ્યો કે જેમના નામ રદ્દમી ઓગસ્ટ, ૨૦૨૨ સુધી કંપનીના ૨જીસ્ટર્ડમાં નોંધાયેલા હોય તેમને મોકલી આપવામાં આવ્યા છે. કૃપ્યા નોંધ લેશો કે, કંપનીના સભ્યોને એમસીએ અને સેબીના

ઇ-હરાજી નોટીસ

S BE	
a sold 🗙 olloger	
Reaching to Unreached	

# બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

## રિજનલ ઓફિસ, સુરતઃ ૩જો માળ, સીટી સેન્ટર કોમ્પ્લેક્ષ, ચોગી ચોક પાસે, વરાછા રોડ, સુરત-૩૯૫ ૦૦૬, ઇમેલઃ rosurat@barodagujaratrrb.co.in, વેબસાઇટઃ www.bggb.in ઇ–ઢરાજી તારીખઃ ૦૪.૧૦.૨૦૨૨

ધી સિક્ચુરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચુરિટી ઇન્ટરેસ્ટ અકટ, ૨૦૦૨ સાથે ધી સિક્ચુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) અધિનિયમ ૨૦૦૨ની કલમ ૮(૬) ની જોગવાઇઓને વેચાણે લેતા સ્થાવર મિલકત અંગેની ઇ-ઓકશન દ્વારા વેચાણ નોટીસ. આથી, અહીં અત્રે જાહેર જનતાને તથા વ્યક્તિગત રીતે લોનધારક(કો) અને જામીનદાર(રો) ને નીચે વર્ણવવામાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના પ્રત્યેક્ષ કબજામાં રહેલી મિલકત તા. o y. ૧૦.૨૦૨૨ ના રોજ સદર હેંકના અધિકૃત અધિકારીએ સદરહું મિલકત ''જ્યાં છે, જે છે'' ના આધાર પર નીચે દર્શાવેલ જામીનપાત્ર, લોન પરનું વ્યાજ, અન્ય ખર્ચા અને (ગુ પડતા ચાર્જની વસ્લાત માટે સકેતીક/પ્રત્યેક્ષ કબજો લીધો છે. ઇ-એકશન તા. o y. ૧૦.૨૦૨૨ ના રોજ https://sarfaesi.auctiontiger.net પર ૧૧.૦૦ થી o ૧.૦૦ દરમિયાન ચોજવામાં આવનાર છે. (Auction Tiger App પર પણ મિલકતોની દરાજી કરવામાં આવશે.) મિલકતની સંપૂર્ણ વિગત, અનામત કિંમત, ઇએમડી અને પઝેશનનો પ્રકાર નીચે દર્શાવેલ છે.

અ. નં.	શાખા નું નામ મોબાઈલ નંબર	કરજદાર(રો) જામીનદાર(રો) ના નામ અને સરનામા	૧૩(૨) મુજબ ૬૦ મહિનાની માંગણા નોટીસ મુજબ કુલ માંગ રક્ષ્મ	સ્થાવર મિલકતની વિગત	_ અનામત કિંમત (ઇએમડી)	કબજા ની સ્થિતી			
٩.	મોબાઇલઃ	કરજદારઃ ૧. શ્રી શૈલેષભાઇ મગનભાઇ પટેલ સરનામુઃ ૩૩, સહજાનંદ રો હાઉસ, પુરૂષોત્તમ ગાર્ડન, અડાજણ, સુરત.	થી અને ચુકવણીની તારીખ સુધી અન્ય ચાર્જીસ,	સ્થાવર મિલકતનો તમામ ભાગ અને હિસ્સો, ફલેટ નં. ૫૦૧ (મિલકત નં. ૧/૯૦) ક્ષેત્રફળ બિલ્ટઅપ એરીયા ૮૯७.૦૦ ચોરસ મીટર, ૫ મો માળ, બિલ્ડીંગ અલ–હુશેન એપાર્ટમેન્ટ, સાથે અવિભાજીત પ્રમાણસર હિસ્સાનું ક્ષેત્રફળ ૧૪.૨૦૯ ચોરસ મીટર  સિટી સર્વે નોંધ નં. ૧७૮૨/૨ ની જમીન પર બાંધવામાં આવેલ ઉક્ત ઇમારતની નીચેની જમીન, ગમતલ એરીયા, મોજેઃ ઓલપાડ, તાલુકોઃ ઓલપાડ, જીલ્લોઃ સુરત ખાતે આવેલ છે. જે શ્રી શૈલેષ મગનભાઇ પટેલ ની છે. ચર્તુસીમાઃ ઉત્તરઃ સોસાયટી રોડ, દક્ષિણઃ પ્રવેશ અને પેસેજ, પૂર્વઃ ફ્લેટનં. ૫૦શ. તાલુ અપ સ્થાર છે. જે શ્રી શેલેષ મગનભાઇ	અનામત કિંમતઃ ૧૧,૯૬,૬૪૦/- (અગીચાર લાખ છન્નુ હજાર છસો ચાલીસ પુરા) ઈએમડીઃ ૧,૧૯,૬૬૪/ (એક લાખ ઓગણીસ હજાર છસો ચોસઠ)	પ્રત્યેક્ષ			
વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને https://www.bggb.in પર આપેલી લિંકનો સંદર્ભ લો. સરકેસી એકટ, ૨૦૦૨ અનુસાર કાથદેસર રીતે ૩૦ દિવસની વેચાણ નોટીસ									
લોનઘારકો/જામીનદારોને આ નોટીસ દ્વારા દરાજીની છેલ્લી તારીખ પહેલાં વ્યાજ અને અન્ય ખર્ચ સાથે માંગણાની રકમ જમા કરાવયા માટે જાણ કરવામાં આવી છે, જેમા નિષ્ફળ જતા, મિલકતોની દરાજી/વેચાણ કરવામાં આવશે અને જો દરાજી/વેચાણ પછી બાકી રહેલી રકમ અને ખર્ચ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે.									
56	સ્થળઃ સુરત - તારીખઃ ૦૫.૦૯.૨૦૨૨ નોંધઃ વિવાદની સ્થિતિમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે. અધિકૃત અધિકારી - બરોડા ગુજર								

Printed by Manojbhai Lalijbhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, Sachin-Palsana Road, Near Sachin, Surat on behalf of owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Lalijbhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manoj